

શ્રી સુધર્માસ્વામી ગ્યાનબંદર

નિઃશ્વાસ  
અનુભૂતિ  
નિર્માણ  
નિર્માણ  
નિર્માણ

૩૦૦૪૮૮૮

૦૨૭૬-૨૨૫૩૨૨

# સંપાદકીય-નિવેદન.



સંવત् ૨૦૦૧ નું અમારું ચાતુર્માસ પાલણુપુરમાં હતું, જીમયે બીજાનેરવાલા સુપ્રસિદ્ધ ઈતિહાસજ્ઞ અને 'ચુગપ્રધાન જીનચંડ્રસૂર' આદિના લેખક શ્રીમાનુ ચાગરચંદ્ર એનું આવવું ત્યાં થયું. પ્રસંગે વાત નીકળતાં તેમણે જણાયું શ્રીમાનુ દેવચંડ્રજી મહારાજની કેટલીએક અપ્રકાશિત ભોનો સંઘર્ષ અમારી પાસે છે, જે કોઈ પ્રકાશિત કરવા ચાહે ખાપી દઈએ, ઉત્તરમાં મોકલવાનું સૂચન કરવાથી તેમણે નકલો મોકલી, તે ઉપરથી આચાર્યપ્રવર શ્રીમાનુ જીનસૂરજી મહારાજનાં વિદ્ધાન શિષ્ય શ્રીબદ્રમુનિજીએ કુંજ અનુસાર અર્થવિચારણાપૂર્વક શોધીને પ્રેસકાપી તૈયાર તેને પ્રેસમાં મોકલી છપાવવું શરૂ કર્યું. તે વખતે જે ફારસમાસ થવા સંભવ હતો, પરંતુ તેના ઉપર ૪ પેજનું વધી જવાથી સુદ્રિત પૂર્વકૃતિઓમાંથી વૈરાગ્યરસપોષક ગી સંજાયો દાખલ કરીને ત્રણ ફારમની આ પુસ્તિકા કુંપેજના પૃષ્ઠ ચોથામાં નિર્દિષ્ટ મહાનુસારોની દ્રવ્યસહાન પ્રકાશિત થતી વાંચેના કરકમળમાં સમપિત કરાય છે.

॥નું સંશોધન કાળજીપૂર્વક કરવા છતાંથે અતિમંદ્તરાદિના જે કંઈ ભૂલ-ચૂક રહી હોય, તે સુધારીને વાંચવાની સાથે આ ક્ષુદ્ર લેખિનીને વિરામ દેવાય છે. ઈતિશામ્.

૨૦૦૨ આ. }  
અષાડ ) }  
। શુક્રવાર ) }  
' મારવાડ ) }

લિં ૨૧૦ અનુયોગાચાર્ય  
શ્રીકેશરમુનિજી ગણિષુવરવિનેય  
અંજીસાગર ગણિ.

ॐ अहं नमः

अध्यात्मतत्त्वनिधि पाठकप्रवर श्रीभद्रेवयंद्रुल गणिवररचित्

# अप्रगट सत्प्रवनादिकांश्चाहुं.



प्राभातिक-४६ ( चैत्राधीन )

अध्यात्मादिक जिनवर चोवीस, प्रहु उठी प्रथमुं सुजगीस;  
चौह सया बावन गणेधार, प्रथमुं अर्द्धते सुखडार. १  
लाख अहुवीस सहस अडयाल, मुनिवर संख्या चिन्तनात;  
लाख चुम्मालीस सहस छेंयाल, चउह सय छ साहुणी विशाल. २  
श्रावक संघ तथो एवार, लाख पंचावन समक्ति धार;  
अडतीस सहस नव तत्त्वना जाणु, दृढधर्म प्रियधर्म वभाणु. ३  
एक होड ने तेरे लाख, सतोतेर हजार सुखाख;  
श्राविका जिनशासन जाणु, शीलवंत ने विनय-प्रधान. ४  
थौविह संघ चोवीसीमांड, नित नित प्रथमुं धरी उच्छाह;  
तीन लुवन जिनभतिभा जेह, प्रहु सम प्रथमुं आणी नेह. ५  
विहुरमान जिनवर छे वीस, कोडी दोय डेवली जगीस;  
कोडी सहस हो सुनिवर सार, चरण-कमल वंहुं सुखडार. ६  
जिनवर आणु वरते जेह, दर्शन ज्ञान प्रभुभ गुणगेह;  
देवयंद्र वंहे सुविहाणु, धन धन उनित जन्म प्रभाणु. ७

## ચૈત્યવંદન.

ત્રિલુલન જન આનંદકંદ, ચંદન જેમ શીતલ,  
જાન ભાનુ ભાસન સમસ્ત, જીવન જગતિ તલ;  
ઉત્કૃષ્ટે જિનરાજ દેવ, સત્તરિ સય લહીયે,  
નવ કોડી કેવલી મુનીશ, સહસ નવ કોડી કહીયે. ૧  
વર્તમાન જિન ધીશ વીશ, હોથ કોડી કેવલી,  
સહસ કોડી હુગ સાધુ સંત, વંદો નિત વલી વલી;  
પ્રણામી ગણુધર સિદ્ધ સર્વ, આમી સવી જીવ,  
આલોઈએ પાતક અઠાર, મિથ્યાત્વ અતીવ. ૨  
સુકૃત કિયા અનુમોદી જીવ, લાવો એમ ભાવન,  
તજી હું કર્મ સવી વિલાવ, પરભાવ કુવાસન;  
તત્ત્વ-રમણુ રસ રંગ રાચી, રત્નત્રય લીનો,  
શુદ્ધ સાધનતા રસી, નિજ અનુભવ લીનો. ૩  
કરી કર્મ ચક્રવર ભૂરિ, કેવલ પદ પામી,  
અંયાભાધ અનંત શાંત, લહીશ હું સ્વામી !;  
એ રૂચિ એ સાધન સહેવ, કરતાં સુખ લહીયે,  
દેવચંદ્ર સિદ્ધાંત તત્ત્વ, અનુભવ રસ ગહીયે. ૪

## પાંચ જિન ચૈત્યવંદન.

જ્ય જિણુવર જ્ય જગનાહ, જ્ય પરમ નિરંજણ,  
જ્ય પરમેશ્વર પાસનાહ, હુખ હોહગ લંજણ;  
વામા ઉરવર હંસલો એ, મુનિવર મન આધાર,  
સમરંતા સેવક શણી, તું તારે સંસાર. ૧  
ચૈત્યવન ચૈત્ર વહી ચોથ (હિન), નમીયા સુર (નર) ઈંદ,  
દશમ પોષ વહી (શુલ સમે), જનમ થયો જિનચંદ;

મેરુશિખર નવરાવીયો એ, મળી ચોસઠ સુરિંદ,  
 પાય પંક નિજ ધોયવા, લેવા પરમાનંદ. ૨  
 પોષહ વહી ધૃગ્યારસે, પ્રભુ સંજમ લોધો,  
 ધીર વીર ખંતિ પસુહ, ગુણ ગણુહ સમિદ્ધો;  
 લોકલોક પ્રકાશકર, પાખ્યા કેવળ નાણુ,  
 ચૈત્રહ વહી ચઉથી દિવસ, અતિશય ગુણુહ પહાણુ. ૩  
 શ્રાવણુ સુદિ આઠમ દિવસ, જિણુ શિવપુર પતો,  
 શ્રી સમ્મેતે અડ અનંત, અવિયલ ગુણુ રતો;  
 કલ્યાણુક જિનવર તણુ એ, આપે પરમ કલ્યાણુ,  
 દેવચંદ્ર ગણુ સંશુદે, પાસનાહ જગાણુ. ૪  
 \* પદ. ( ઐર ઐર નહિં આવે—એ રાગ. )

પ્રભુ સમરણુકી હેવા રે હમકું પ્રભુૠ

પ્રભુ સમરણુ સુખ અનુભવ તોલે, નાવે અમૃત કલેવાખરે....હમકું૦૧  
 એક પ્રદેશ અનંત ગુણાલય, પર્યાય અનંત કહેવા રે....હમકું૦૨  
 પર્યાય પર્યાય ધર્મ અનંતા, અસ્તિત નાસ્તિ હુગ લેવા રે....હમકું૦૩  
 પ્રભુ જાને સો સબકું જાને, શુચિ લાસન પ્રભુ સેવા રે....હમકું૦૪  
 દેવચંદ્ર સમ આતમ સત્તા, ધરે ધ્યાન નિત મેવા રે....હમકું૦૫

પદ. રાગ-જ્યજ્યવંતી

જાન અનંતમયી, દાન અનંત લઈ,  
 વીર્ય અનંત કરી, લોગ અનંત હૈ. ૧  
 ક્ષમા અનંત સંત, મહેવ અજ્જવવંત;  
 નિસ્પૃહતા અનંત ભયે, પરમ પ્રસંત હૈ. ૨  
 રિથરતા અનંત વિલુ, રમણ અનંત પ્રભુ;  
 ચરણ અનંત ભયે, નાથજ મહંત હૈ. ૩

\* આ પહોં સ્તવનઽપે ઐલાય.    × સિરામણુ.



हेवयांद को है धृद, परम आनंदकंद;  
अक्षय समाधि वृद्ध, समता को कंत है. ४  
( जिन भाल वर्णन ) पद. राग-नायकी.

जिनल ! तेरा भाल विशाला.

सित अष्टभी शशि सम सुप्रकाशा, शीतण ने अखियाला. जिनल. १  
उत्तम जनको सिद्धशिलाका, अनुभव हेतु उराला;  
समक्षित थीज अङ्कूर वृद्धिका, एह अमल x आलवाला. जिनल. २  
साधकको संज्ञम तरु रोपण, एहीज अनुभव थाला.  
वणी रेखा नरपति सुरपतिको, हित उपदेश प्रणाला. जिनल. ३  
बीर्ध्वतिलक रेखा युग सोडे, उपशम जलधि उछाला,  
हेवयांद्र प्रलु भाल अनुपम, समता सरोवर पाला. जिनल. ४ ·  
( जिन भू वर्णन ) पद. राग-सारंग.

अति नीके भू जिनराज के (२)

अङ्क रत्न धुति सण हारी, श्याम सुडेमण नाञ्जुके....अतिं १  
मोह महन अरि विजय करनको, मानु कृपाणु सुसाज्जुके. अतिं २  
कर्म कटक निवारनको धन, धनुष विवेक सुराज के....अतिं ३  
भमर पंक्ति मुखकज रस लीनी, अङ्कूरे गुणु राज्जुके....अतिं ४  
हेवयांद्र भवजलधितरनको, सठ ए श्याम जहाज के....अतिं ५

( जिन नयन वर्णन ) पद. राग-कनडो.

नीके नयन तुमारे हो लुनल. (२)

सकल विशेष सामान्य विलोकने, मानु द्रव्य गुणु सारे. हो जिनल० १  
निःस्पृहता प्रलुताके भाजन, भविकुं लागत घ्यारे. हो जिन० २  
समता मोहन ओहन भमता, अति तीजे अखियारे. हो जिन० ३

x क्यारे.

યાકી સ્થિરતા ને જન લીને, તિણુ નિજ કાજ સમારે. હો જિન૦ ૪  
હેવચંદ્ર હૃગ છવિ અતિ અદ્ભુત, ધો હૃગમેં અવતારે. હો જિન૦ ૫

( જિન નાસિકા વર્ણન. ) ૫૬—રાગ—કેરણો.

અતિ અદ્ભુત પ્રલુદી નાસિકા (૨)

તીન ભુવનમેં ઉપમા નાંહિ, અવિનાશી સુખ વાસિકા. અતિ૦ ૧  
મોહ મહારિપુ કંદ નિકંદન, વિજય પતાકા આસિકા. અતિ૦ ૨  
નિર્વિકાર ૫૬ રસિક લવિકું, લક્ષ્મિ પ્રમોદ ઉદ્વાસિકા. અતિ૦ ૩  
નિશ્ચય રતનત્રયી આરાધન, સાધન માર્ગ વિકાશિકા. અતિ૦ ૪  
હેવચંદ્ર સુખકજ પ્રતિષેધન, ચંદ્રકળા સુપ્રકાશિકા. અતિ૦ ૫

( જિન શ્રવણ વર્ણન. ) ૫૬. રાગ—કેદાર.

સુંદર શ્રવણુકો આકાર, જિન ! તેરે શ્રવણુકો આકાર;  
ભવ સમુદ્ર જલ પાર ઉતારન, પોતકે અનુહાર. સું. ૧  
અનાહિ વિભાવ કંકર નિકાસન, પ્રાકપાત્ર સમ સાર. સું. ૨  
મહા મોહકો જહર હરણું, ગરૂડ પક્ષ અવિકાર. સું. ૩  
વિશાહ બોધ સુક્તાકુળ પ્રગટન, અવધિ મહુકી (?) ચાર. સું. ૪  
હેવચંદ્ર પ્રલુ શ્રવણ સ્તવનસેં, પરમ સૌખ્ય વિસ્તાર. સું. ૫

( જિન સુખ વર્ણન. ) ૫૬. રાગ—મલ્હાર.

હું તો પ્રલુ ! વારી છું તુમ સુખની, હું તો જિન ખલિહારી તુમ સુખની;  
સમતા અમૃતમય સુપ્રસન્ન નિત, રેખ નહિ રાગ રૂખની. હું તો ૧  
ભ્રમર અર્ધશશિ ધનુહ કમલ દલ, કીર હીર પુનમ શશિની;  
શોભા તુચ્છ થઈ પ્રલુ હેખત, કાયર હાથ જેમ અસિની. હું તો ૨  
મનમોહન તુમ સન્મુખ નિરખત, આંખ ન તૃપતિ અમચી;  
મોહ તિમિર રવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરતિ એ ઉપશમચી. હું તો ૩  
મનની ચિંત મિટી પ્રલુ ધ્યાવત, સુખ હેખતાં તત્તુની;

x સુપ્તિ:

ઇદ્રિય તૃપા ગઈ સેવંતાં, ગુણ ગાવંતાં વચનની. હું તો ૧૦ ૪  
મીન ચકોર મોર મતંગજ, જલ શશિ ધન નિજ વનથી;  
તેમ કુજ પ્રોતિ સાહેખ સુરતથી, ઔર ન ચાહું મનથી. હું તો ૧૦ ૫  
શાનાનંદન જગ આનંદન, ,આશ દાસતી ધૂતની;  
દેવચંદ્ર સેવનમે અહનિશિ, રમણે પરિણુતિ ચિતના. હું તો ૧૦ ૬

### શ્રી ઋષલજિન સ્તવન.

(રાગ-પ્રભાતી)

આજ આનંદ વધામણા, આજ હર્ષ સવાઈ;  
ઋષલ જિનેશ્વર વંદીયે, અનુપમ સુખદાધ. આજો ૧  
સારથવાહ લવે લહી, શુચિ રચિ હિતકારી;  
આનંદ વૈદ લવે કરી, મુનિ સેવા સારી. આજો ૨  
ચક્કી લવ સંજમ લહી, થાનક (વીસ) આરાધી;  
સર્વાર્થસિદ્ધથી ચવી, જિન પદવી લાધી. આજો ૩  
કાળ અસંખ્ય જિન ધર્મનો, પ્રભુ વિરહ મિટાયો;  
ગણુધર મુનિ સંધ થાપના, કરી સુખ પ્રગટાયો. આજો ૪  
મરુદેવા સુત દેખતાં, અનુભવ રસ પાયો;  
દેવચંદ્ર જિન સેવના, કરી સુજસ ઉપાયો. આજો ૫  
**ચૂડા નગરસ્થ શ્રી સુવિધિનાથ-સ્તવન.**

નાનો નાહલોરે-એ દેશી

**સુનિધિ જિનેશ્વર!** વોનતીરે; દાસતણી અવધાર સાહેખ! સાંભળો રે.

ત્રિલુલન જાણુગ આગળે રે, કહેવો તે ઉપચાર. સાઠ ૧  
પ્રભુ છો પરમ દ્વાનિધિ રે, સેવક હીન અનાથ. સાઠ  
ઉવટ લવ લમતાં લણી રે, તુઝ શાસન વર સાથ. સાઠ ૨  
મેં પુદુગળ રસ રીજથી રે, વિસાર્યો નિજ લાવ. સાઠ  
**\*આપા પર ન પિછાણીએ રે, પોષ્યો વિષય વિલાવ.** સાઠ ૩

\* આત્મા.

પુષ્ય ધર્મ કરી થાપીયો રે, વિષય પોષ સંતોષ. સાઠ  
 કારણુ અરજ ન ઓળખ્યો રે, કીધ્યો રાગને દોષ. સાઠ ૪  
 પ્રલુબુ આણુા ચિત્ત નવી રમી રે, સેવ્યો પાપ સ્થાન. સાઠ  
 મમતા મહ માતો થકો રે, ચિત્ત ચિંતે હૃદ્યાન. સાઠ ૫  
 રામાનંદનં પ્રલુબુ મહ્યો રે, સુશ્રીવ ભૂપ કુલ ચંદ. સાઠ  
 શ્વેત વર્ણ ધરજ + મીનનો રે, સમતા રસ મકરંદ. સાઠ ૬  
 ચૂડાપુરે ચૂડામણિઓ, મનમોહન જિનરાય. સાઠ  
 દૈવચંદ્ર પદ સેવતાં રે, પરમાનંદ સુખ પાય. સાઠ ૭

### ફ્લોએધી મંડન શ્રી શીતલનાથ સ્તવન.

શ્રી શીતલ જિન સેવિયે રે લો, મન ધરિ ભાવ અપાર રે વાલેસર,  
 હંસેન્દ્ર હરએ હૃદયો રે લો, દેખણુ તુઝ દિદાર રે વાઠ શ્રી૦ ૧  
 સેવક જાણી આપણો રે લો, જે ધરસો નહિ નેહ રે વાઠ  
 લગત વચ્છલનો બિરુદ્ધ તો રે લો, કેમ પાળશો એહદે વાઠ શ્રી૦ ૨  
 આશ ધરી આવે જિકે રે લો, આસ્તંગાયત હાસ રે વાઠ  
 આશા પૂરણુ સુરમણિ રે લો, કરી તુઝ પર વિશ્વાસ રે વાઠ શ્રી૦ ૩  
 ચોણ મળુઠ તણી પરે રે લો, રાખે જે મન રંગ રે વાઠ  
 તેહને વંછિત આપીયે' રે લો, કર અપણાયત અંગ રે વાઠ શ્રી૦ ૪  
 વયણુ નિવાહુ સુજ મજ્યો રે લો, અંતરનભી સ્વામ રે વાઠ  
 ક્ષણુ એલે પલે ક્ષણે રે લો, નાંહિ તેહશું કામ રે વાઠ શ્રી૦ ૫  
 આશ ધરું એક તાહરી રે લો, અવર નહિં વિશ્વાસ રે વાઠ  
 નામ સુણીને તાહરો રે લો, મનમેં ધર્દં ઉદ્વલાસ રે વાઠ શ્રી૦ ૬  
 તુંહીજ સુભ મન હંસલો રે લો, તુંહીજ સુજ ઉર હાર રે વાઠ  
 આણુ ધર્દં શિર તાહરી રે લો, એ માહરી એકતાર રે વાઠ શ્રી૦ ૭

તुंतર + સાહિબ સેવતાં રે લોા, સેવકના ગુણ જાય રે વાં  
 ગિરુઆ નિરવાડુ ગુણી રે લોા, તકીયેં તાસ સહાય રે વાં શ્રી૦ ૮  
 ક્ષણુ રાચે વિરચે\* ક્ષણે રે લોા, જે સ્વારથીઆ ભીત રે વાં  
 પ્રારથીયા પછીડે જિડે રે લોા, તેહશું કેવી પ્રીત રે વાં શ્રી૦ ૯  
 જે મનના ( સંશય હણે ) રે લોા, ઉપગારી થિર ટેક રે વાં  
 જે ગુણ અવગુણ એળાખે રે લોા, મળીયેં તસુ સુવિવેક રે વાં શ્રી૦૧૦  
 જે ચાહે આપણ લણી રે લોા, નિત નિત નવલે હેજ રે વાં  
 તેહને વંછિત આપતાં રે લોા, કિણ વિધ ક્રીજેં જેજ્ઞ રે વાં શ્રી૦૧૧  
 સેવક નિત સેવા કરે રે લોા, પણ ન લહે બક્ષીસ રે વાં  
 પાર પખી એમ પ્રીતડી રે લોા, કેમ ચાલે જગ્હાસ રે વાં શ્રી૦૧૨  
 સેવકને જે આપીયે રે લોા, વાર એક શાખાસ રે વાં  
 તો હરાખે સેવક રહે રે લોા, જાં જીવે તાં પાસ રે વાં શ્રી૦૧૩  
 જ્યાં લગી ભવમેં હું ભમું રે લોા, ત્યાં લગી તું મહારાજ રે વાં  
 સેવક જાણી નિવાજીયે રે લોા, નાથ ગરીખનિવાજ રે વાં શ્રી૦૧૪  
 હું સુખદાયક નાથ તું રે લોા, તુંહીજ મુજ શિરસાઢ રે વાં  
 અવર રંક કોણ આસરે રે લોા, લહી સાહિબ ગજગાહ રે વાં શ્રી૦૧૫  
 જિન મુખ દીઠાં હી થકાં રે લોા, અળગા ગયા ઉદ્ઘેગ રે વાં  
 સુખ સંપત્તિ મન કામના રે લોા, આય મળી મુજ વેગ રે વાં શ્રી૦૧૬

### કળશા.

એમ સથલ સુખકર દશમ જિનવર, નામ શીતળ શીતલો,  
 જેષ્ઠો ફ્લોધી પુર મનોહર જ્ઞાન ચારિત ગુણનીલો;  
 ઉવાય વર રાજસાર વાચક, જ્ઞાનધર્મ મુણુંદ એ,  
 ગણુ રાજહંસ સુસીસ દૈવચંદ્ર લઘો સુખ આણુંદ એ. ૧૭

+ તમાર શિવાય ધત્ત?—અન્ય.

\* નાયુશ.

× ઢીલ.

## श्री धर्मनाथ स्तवन. ( राग-सारंग. )

हम धृश्की जिन गुण गान के ( २ )

पुङ्गल रुचिसुं विरसी रसीले, अनुभव अभृत पान के. हम० १  
 के धृश्की वनिता भमता के, के धृश्की धन धान के,  
 हम तो लायक समता नायक, प्रबु गुण अनांत खजन के. हम० २  
 केठक राणी है निज तनके, के अशनादि खान के,  
 के चिंतामणि सुरतरु धृच्छक, केठ पारस पाहान के. हम० ३  
 चिदानंधन परम अदृपी, अविनाशी अभिलान के,  
 हम लयलीन पीन है अहनिशि, तत्परसिके तान के. हम० ४  
 धर्मनाथ प्रबु धर्म धुरंधर, डेवल ज्ञान निधान के,  
 चरण शरण ते जगत शरण है, परमात्म जग लान के. हम० ५  
 शीति गई प्रगटी सभ संपत्ति, अभिलाषी जिन आणु के,  
 देवचंद्र प्रबु नाथ किये। अथ, तारणु तरणु पिण्ठान के. हम० ६

## शांतिनाथ स्तवन.

शांति जिनेश्वर लेटीये रे, शांत सुधारस रेल. जये। जिनशासने रे.  
 पुष्करावर्त जलधर सभो रे, सींचवा समक्ति वेल. जये।० १  
 मात अचिरा उर हुंसतो रे, विश्वसेन राय महार. जये।०  
 लाख वरस सवी आउओ रे, धनुष चालीस तनु धार. जये।० २  
 कुमर भंडलिक चक्रपणे रे, जिनपणे सहस चरीस. जये।०  
 वर्ष लगी लोगवी संपदा रे, निपलु सिद्धि जगीस. जये।० ३  
 नामथी विद्व सवी उपशमे रे, सेवतां परमानंद. जये।०  
 उपशम भंगल लीलना रे, स्वाभी छो कृपतरु कंद. जये।० ४  
 हैव गुरु शुद्ध सत्ता थकी रे, निर्मल सुख सुविशाण. जये।०  
 देवचंद्र शांति सेवा करो रे, नित वधे भंगलभाण. जये।० ५

## શ્રી નેમિનાથ-સ્તવન. ( રાગ-સારંગ )

આયો રી ધન ધોર ધટા કરકે (૨) .... .... ....  
 રહુત પપીહા પિઉ પિઉ પિઉ પિઉ, (પિઉ પિઉ) સર ધરકે. આયો ૧  
 વાદર ચાદર નલ પર છાઈ, દામિની દમકતી અરકે;  
 મેઘ ગંભીર શુહીર અતિ ગાજે, વિરહિની ચિત્ત થરકે. આયો ૨  
 નીર છટા વિકટા સી લાગત, મંદ પવન ઝરકે,  
 નેમિનાથ પ્રલુબ વિરહ વ્યથા તવ, અંગ અંગ કરકે. આયો ૩  
 દુંડુર મોર શોર ભર સાલત, રાણુલ હિલ પરકે,  
 દૈવચંદ્ર સંયમ સુખ હેતાં, વિરહ ગયો ટરકે. આયો ૪

(૨) રાગ કેદારો. ( સુવિધિ જિતેશ્વર પાય નમીને )

વાલાળુ વીનતડી એક મારી, ધીરું બોલે રાણુલ નારી રે;  
 હું દાસી છું શ્રી પ્રલુલની, પ્રલુબ છો પર ઉપકારી રે. વાં ૧  
 ગ્રેમ ધરી સુજ મંદિર આવો, પૂરવ નેહ સંભારી રે;  
 સજજન પ્રીતિ મધુરતા સ્વાદે, અમૃત હીધ ઉવારી રે. વાં ૨  
 એક વાર જો વચન નિવાહી, હેતા જો કરતાણી રે;  
 તોરણુથી ચાલ્યા રથ વાળી, એ શ્રી પ્રીતિ સંભાળી ? રે. વાં ૩  
 લોક કહે ને પ્રીત ન પાળી, એ સાચી પ્રીત નિહાળી રે;  
 મોહ વિલાવ ઉપાધિથી ટાળી, આત્મ સમાધિ હેખાળી રે. વાં ૪  
 અષ્ટ ભવો લગી નેહ નિવાહ્યો, નવમે લવ પલટાયો રે;  
 ગુણુ રાગે હો રાગ ઉપાયો, પરમ તત્ત્વ નિપણયો રે. વાં ૫  
 રસકૂંપી રસ લોહને વેધે, કંચનતા પ્રગટાવે રે;  
 નેમ ગ્રેમ રસ વેધી રાણુલ, લવ લય ઠ્યાધિ મિટાવે રે. વાં ૬  
 સાચી પ્રીત રાળુમતી રાખી, અવિહૃડ રંગ સદાઈ રે;  
 દૈવચંદ્ર આણુા તપ સંયમ, કરતાં સિદ્ધ નિપાધ રે. વાં ૭

## શ્રી જગવદ્વાલ પાચ્છેજિન સ્તવન.

જગવદ્વાલ જિનરાજજી !, અરજ એક અવધારો જી;  
 કૃપા કરી ભવજલધિથી, મુજને પાર ઉતારો જી. જગો ૧  
 જગતારક જગનાથ તું, જિન સ્વારથ જગ ભાતા જી,  
 સારથવાહ નિર્યામડો, જગવદ્વાલ જગ માતા જી. જગો ૨  
 એહવા જાણી આશ્ર્યો, નિજ શિવસુખ હેતે જી;  
 ગુણ અનંતતા સ્વામિની, અદ્વિતીય ન થાવે હેતે જી. જગો ૩  
 પ્રભુ લાયે સંવરપણે, શુદ્ધાત્મ ભાવો જી;  
 સ્વાદ્ધાર એકત્વતા, તો મુજ સરિખા થાવો જી. જગો ૪  
 વદ્વાલતા તેથી અછે, જિન પ્રવચન ઉપગારે જી;  
 પણ આદરતાં દોહિલો, છતે મોહ પરિવારે જી. જગો ૫  
 તેણે પ્રભુ તેહલું કરો, નાશો મોહ અજ્ઞાનો જી;  
 મોટાની સુનજર થકી, ધાયે સહુ આસાનો જી. જગો ૬  
 કૃપાસિનંદુ જિનજી કદ્દો, છચે દ્રોય નિજ ભાવે જી;  
 નિજ યથાર્થતા સદ્હોં, અનેકાન્તતા દાવે જી. જગો ૭  
 અહણાયહણુ પરીક્ષણી, કારણુ કારજ જોગે જી;  
 લેદાલેદ અનંતતા, જાણો નિજ ઉપયોગે જી. જગો ૮  
 સ્વ સ્વરૂપ નિજ આચરો, નિમિત્ત અને ઉપાદાને જી;  
 ચોગ અવંચકતા કરી, નિર્મળ વધતે ધ્યાને જી. જગો ૯  
 એહવા ગુણ જેહના અછે, સકળ શુદ્ધતા ભાસે જી;  
 તર્યા તરે છે જેહથી, તરશે તાસ અદ્યાસે જી. જગો ૧૦  
 પ્રભુજીને અગ્રેસરી, આગમ અગમ પ્રલાવી જી;  
 જિનજી પરમ કૃપા કરી, તેહથી લેટ કરાવી જી. જગો ૧૧

ચરમ પ્રમોદ થયો હવે, જે મહ્યો શુત સહભાવે છુ;  
 સ્વાક્ષાદ અનુભવ કરી, સાધો સિદ્ધ સ્વભાવે જ. જગો ૧૨  
 ત્રૈવીસમો જિનરાજજી, સુપ્રસાહે આરાધે છુ;  
 હેવચંદ્ર પદ તે લહે, પરમ હર્ષ તસુ વાધે જ. જગો ૧૩  
 પાર્શ્વનાથ સ્તવન. ( શી કંડું કથની મારી...રાજ-એ રાગ )

મુખને દાસ ગણ્યુને રાજ, પાર્શ્વજી ! અજ્ઞ સુણ્યુને.  
 અવસર આજ પૂરીને રાજ, પાર્શ્વજી અજ્ઞ સુણ્યુને. (આંકડી)  
 વામાનંદન તું આનંદન, ચંદન શોતલ ભાવે,  
 હુંઘ નિકંદન ગુણે અનિંદન, કીને વંદન ભાવે રાજ. પાર્શ્વજી ૧  
 તુંછીજ સ્વામી અંતરણમી, મુખ મનનો વિસરામી;  
 શિવગતિગામી તું નિષ્ઠામી, ખીન હેવ વિરામી રાજ. પાર્શ્વજી ૨  
 ભૂરતિ તારી મોહનગારી, પ્રાણ થકી પણ ર્યારી;  
 હું અલિહારી વાર હજારી, મુખને આશ તુમહારી રાજ. પાર્શ્વજી ૩  
 કે એકતારી કરે અતારી (?), લીને તેહને તારી;  
 પ્રીતિ વિચારી સેવક સારી, હીને કેમ વિસારી રાજ. પાર્શ્વજી ૪  
 વિધન વિદારી સ્વામી સંભારી, પ્રીતિ ખરી મેં ધારી;  
 શંક નિવારી ભાવ વધારી, વારી તુઝ ચરણાંંરી રાજ. પાર્શ્વજી ૫  
 મિત નર નારી બહુ પરિવારી, પૂજ રચે તુઝ સારી;  
 હેવચંદ્ર સાહિબ સુખદાધી, પૂરો આશ હમારી રાજ. પાર્શ્વજી ૬

### ગોડી પાર્શ્વ જિન સ્તવન.

જગજીવન ત્રૈવીશમા, ગિરુચા ગોડી પાસ લાલ રે;  
 દુરિસણ દેખણ દેવનો, અછે અધિક ઉલ્લાસ લાલ રે. જગો ૧  
 ઝુણ સુણ સુણ સુણ સાહિબા !, દાસ તણી અરહાસ લાલ રે;  
 આસ કરે જે આપની, પૂરજો તસ આસ લાલ રે. જગો ૨

મન તન વિકસે હો માહરો, દીઠે તુઝ દીદાર લાલ રે;  
 મોાહન મૂર્તિ મન વસ્તી, સહજ સદ્ગુણી સાર લાલ રે. જગો ૩  
 નામ સુણુંતાં જેહનો, વિકસે સાતે ધાત લાલ રે;  
 તે જે સન્સુખ લેટીયે, તો કહો કેહવી વાત લાલ રે. જગો ૪  
 જે દિન પ્રભુ પથ પૂજશું, તે દિન ધન્ય વરણીશ લાલ રે;  
 તુઝ દર્શન વિષુ દીહડા, લેખેમેં ન ગળીશ લાલ રે. જગો ૫  
 મહેર નજર કરી સુઝ પરે, અવગુણુ ગુણુ કરી લેહઃલાલ રે;  
 સેવક જાણી દ્યા કરી, અવસર દરિસણ દેહ લાલ રે. જગો ૬  
 આઠ પહોાર સમરણ કરે, ધરી ઘરી એકતાર લાલ રે;  
 તે ચાડરની સ્વામીજી !, કીજે અવરથ સંભાર લાલ રે. જગો ૭  
 દ્વર થકા પણ ગુણુ થહે, પાપે અવિહડ પ્રીત લાલ રે;  
 પાસ જિનેવર ! તેહની, કીજે હરવિધ ચિંત લાલ રે. જગો ૮  
 અળગા પણ તે દ્યુંકડા, જેહ વસે મન માંય લાલ રે;  
 પાસ થકા પણ ટાળીયે, જે દીડા ન સુહાય લાલરે. જગો ૯  
 દીઠાં હુઃખ દોહગ ટળે, લેખ્યાં લાવઠ નય લાલ રે;  
 પાપ પણુસે પૂજતાં, સેવંતાં સુખ થાય લાલ રે. જગો ૧૦  
 તું જગવદ્ધાસ જગશુરુ, તુંહીજ દીનદયાળ લાલ રે;  
 તુંહીજ સેવક-જન તણુા, ટાપે સ્કરુણ જંનાળ લાલ રે. જગો ૧૧  
 દ્વર થકાં પણ માહરો, તુંહીજ જીવન પ્રાણુ લાલ રે;  
 નજર તળે આવે નહિ, ઓને દેવ અણણ લાલ રે. જગો ૧૨  
 તુઝ સમરણ મનમેં કરું, નામ જપું તુમ લણ લાલ રે;  
 તુઝ દરિસણુની આશથી, બોલે છે સુઝ દીહ લાલ રે. જગો ૧૩  
 દીપચંદ્ર સફુશુરુ તણ્ણો, શિષ્ય કહે જિનરાજ લાલ રે;  
 દૈવચંદ્રની મન રણી, પૂરજે મહારાજ લાલ રે. જગો ૧૪

## દીવાળી-સ્તવન.

આજ મારે દીવાળી થઈ સાર, જિન સુખ હોડાંથી; (આંકડી) અનાદિ વિલાષ તિમિર રથથીમેં, પ્રભુ દર્શન આધાર રે; સમ્યગું દર્શન હીપ પ્રકારથો, જ્ઞાન જયોતિ વિસ્તાર. જિન૦ ૧ આતમ ગુણ અવિરાધન કરુણા, ગુણ આનંદ પ્રમોદ રે; ઘરભાવે અરક્ત દ્વિષ્ટતા, મધ્યસ્થતા સુવિનોદ. જિન૦ ૨ નિજ ગુણ સાધન રસિય મૈત્રી, સાધ્યાલંખી રીતિ રે; સમ્યકું સુખડી રસ આસ્તવાદી, ધૃત તંષોલ પ્રતીતિ. જિન૦ ૩ જિનસુખ હીઠે ધ્યાન આરોહણ, એહ કલ્યાણુક વાત રે; આતમ ધર્મ પ્રકાશ ચેતના, દૈવચંદ્ર અવહાત. જિન૦ ૪

## શ્રી અષ્ટાપદ-સ્તવન

લેટો લેટો શિવસુખ કાજ, ભવિજન ! એ તીરથને,  
મેટો મેટો મોહ અનાદિ, લવ ભવના સંકટને. ( એ ટેક )  
શ્રી અષ્ટાપદ ગિરિવર ઊપર, જિનવર ચૈત્ય જુહારે;  
ભરત ભૂપ કૃત ચૌસુખ સુંદર, શિવસુખ કારણ ધારો. લેટો૦ ૧  
અહુ ભવસંતતિ કર્મ સહિત પણ, જે લેટો એ ઠામ;  
શ્રોત્ર નિમિત્તે શુચિ પરિણામે, પામે નિજ ગુણ ધામ. લેટો૦ ૨  
અષ્ટલ જિનેશ્વર પરમ મહોદ્ય, પામ્યા છુણુ ગિરિ શૂંગે;  
ગ્રિદાનંદધન સંપત્તિ પૂરણ, સિદ્ધા બહુ મુનિ સંગે. લેટો૦ ૩  
ભરત મુનીશ્વર આતમ સત્તા, પ્રગટપણે શ્રદ્ધાં કીધ;  
ધ્યાન પરિપાઠ અસંખ્ય સંજમી, સર્વ સંવર પદ લીધ. લેટો૦ ૪  
જે નિજ સત્તા તત્ત્વ સ્વરૂપે, ધ્યાન એકત્રે ધ્યાવે;  
અનેકાન્ત ગુણ ધર્મ અનંતા, થાવે નિર્મણ ભાવે. લેટો૦ ૫  
તેહનું કારણ આતમ ગુણુત્ત્ય, તસુ કારણ જિનરાજ;  
અસુ બહુમાન ભાન હેતુ એ, તેમ એ ભવોદ્યિ પાજ. લેટો૦ ૬

મિથ્યા મોહ વિષય રતિ ધીઠી, નાશો તીરથ દીઠી;  
 તત્ત્વરમણું પ્રગટે ગુણુશ્રેણો, સકળ કર્મદળ નીઠી. લેટો ૭  
 ઠવણું લાવ નિક્ષેપ ગુણીના, સમતાલંઘન જાણી,  
 ઠવણું અષ્ટાપદ તીરથવર, સેવો સાધક પ્રાણી. લેટો ૮  
 ભવ જળ પાર ઉતારણું કારણું, હુઃખ વારણું એ શૃંગ,  
 સુક્રિત રમણીનો દાયક લાયક, તેમ વંદો મનરંગ. લેટો ૯  
 તીરથ સેવન શુચિ પદ કારણું, ધારી આગમ સાખે;  
 શાહ આણુંદળ લક્ષ્મિ વિશેષ, થાપ્યો ગુણ અભિલાષે. લેટો ૧૦  
 સાધ્ય દાષ્ટ સાધનની દુષ્ટે, સ્યાદ્ધાદ ગુણવૃંદ;  
 દૈવચંદ્ર સેવે તે પામે, અક્ષય પરમાનંદ. લેટો ૧૧

### (૧) શ્રી સમુત્તેત શિખર સ્તવન.

શ્રી સમુત્તેત ગિરીનંદ !!! હર્ષધરો વંદો રે ભવિકા !  
 પૂરવ સંચિત પાપ તુમે નિકંદો રે ભવિકા !  
 જિન કલ્યાણુક થાનક દેખો આણુંદો રે ભવિકા. ! શ્રી. (૬૫.)  
 અજિતાદિક દસ જિનવડ રે, વિમલાદિક નવ નાથ;  
 પાર્વિનાથ લગવાનજુ રે, ધર્માં લદ્ધા શિવપુર સાથ. રે,  
 ભવિકા. શ્રી ૧

કલ્યાણુક પ્રલું એકનું રે, થાયે તે શુચિ ઢામ;  
 વીસ જિનેશ્વર શિવ લદ્ધા રે, તેણે એ ગિરિ અભિરામ રે;  
 ભવિકા. શ્રી ૨  
 સિદ્ધ થયા ધણુ ગિરિવરે રે, ગણુધર મુનિવર કોડિ,  
 ગુણ ગાવે, એ તીર્થના રે, સુરવર હોડા હોડિ રે. ભવિકા શ્રી ૩  
 પરમેશ્વર નામે અછે રે, વીસે દૂંક ઉતુંગ;  
 ચરણું કમલ જિનરાજના રે, સુર પૂજે મનરંગ રે. ભવિકા શ્રી ૪

ભાવ સહિત લેણ્યો જિણે રે, ગિરિવર એ ગુણુ ગેહ;  
જિન તન ઝરસી ભૂમિકા રે, ઝરસે ધન્ય નર તેહ રે, લવિકા. શ્રી૦ ૫  
નામ થાપના છે સહી રે, ૬૦૪ લાવને હેત;  
સંશય તળુ સેવો તુમે રે, ઠવણુ તીર્થ સમ્મેત રે; લવિકા. શ્રી૦ ૬  
તીરથ હીઠે સાંભરે રે, દેવચંદ્ર જિન વીસ;  
શુદ્ધાશય તન્મય થઈ રે, સેણ્યાં પરમ જગહીસ રે. લવિકા. શ્રી૦ ૭

(૨) વિંદ્લે ભાર ધણ્ણો છે રાજ! વાતાં કેમ કરો છો—એ રાગ.

લેણ્યો ભાવ ધરી મેં આજ, એ તીરથ ગુણુ ગિરુએ....ટેક૦  
જંબુદ્ધીપ દક્ષિણ વર ભરતે, પૂરવ દેશ મજાર;  
શ્રી સમ્મેત શિખર અતિ સુંદર, તીરથ મેં સરહાર. લેણ્યો૦ ૧  
વીસ જિનેશ્વર શિવપદ પાભ્યા, ઈણુ પરવતને શૃંગે;  
નામ સંભારી પુરુષોત્તમના, ગુણુ ગાવો મનરંગે. લેણ્યો૦ ૨  
એમ ઉત્તર હિંશ ઔરવત ક્ષેત્રે, શ્રી સુપ્રતિષ્ઠ નગેન્દ્ર;  
શ્રી સુચંદ્ર આદિક જિનનાયક, પાભ્યા પરમાનંદ. લેણ્યો૦ ૩  
એમ દશ ક્ષેત્રે વીસે જિનવર, એક એક ગિરિવર સિદ્ધ;  
તિત્થોગાલી પયજ્ઞા માંડે, એ અક્ષર પ્રસિદ્ધ. લેણ્યો૦ ૪  
એ તીરથ વંદે સવી વંધા, જિનવર શિવપદ ઠામ;  
વીસે ટૂંક નમો શુલ ભાવે, સંભારી પ્રભુ નામ. લેણ્યો૦ ૫  
તરીયે જેહને સંગ લવોધધિ, ન્રણુ રતન જિહાં લહિયે;  
જે તારે નિજ અવલંખનથી, તેહને તીરથ કહીયે. લેણ્યો૦ ૬  
શુદ્ધ પ્રતીતિ ભક્તિથી એ ગિરિ, લેણ્યાં નિર્મણ થઈએ;  
જિન તનુ ઝરસી ભૂમિ દરસથી, નિજ દરસન થિર કરીએ. લેણ્યો૦ ૭  
સૂત્ર અર્થધારી પણુ મુનિવર, વિચરે દેશ વિહારી;  
જિનકલ્યાણુક થાનક હેખી, પણી થાય પદ ધારી. લેણ્યો૦ ૮  
શ્રી સુપ્રતિષ્ઠ સમ્મેત શિખરની, ઠવણુ કરી જે સેવે;

શ્રી શુક્રરાજ પરે તીરથ ક્રૂ, ધર્માં એડા પણ લેવે. લેખ્યો ૮  
તસુ આડાર અભિપ્રાય તેહને, તે બુદ્ધ તસુ કરણી;  
કરતાં ઠવણું શિવ ક્રૂ આપે, એમ આગમે વરણી. લેખ્યો ૧૦  
નેણું એ તીરથ વિધિશું લેખ્યો, તે તો જગ સંસારાને;  
તે ઠવણું લેટાંત અમે પણ, નર લવ લાડો લીજે. લેખ્યો ૧૧  
દશ ક્ષેત્રે એક એક ચોવીસી, વીસ કિનેસર સીએ;  
સિદ્ધક્ષેત્ર બહુ જિનનો હેખી, માહુરો મનડો રીજે. લેખ્યો ૧૨  
દીપચંદ્ર પાડકનો વિનયી, દૈવચંદ્ર એમ ભાસે;  
જે જિન લક્તે લીના લવિજન, તેહને શિવસુખ પાસે. લેખ્યો ૧૩

( ૩ ) ધડી એક ઘોને રાણી સુંખરો—એ દેરા.

શ્રી સમ્મેતશિખર વરુ, તીરથ સિરદાર;  
જિહાં જિનવર શિવપદ વર્યા, મુનિવર ગળુધાર. શ્રી સમ્મેત૦ ૧  
શ્રી અજિતાદિક જિનવરા, ચૌવિહ સંધ સમેત;  
આંયા એ ગિરિ ઉપરે, ધારી શિવ સંકેત. શ્રી સમ્મેત૦ ૨  
કાઉસર્સંગ મુદ્રા ધરી, કરી ચોગ નિરોધ;  
સકળ પ્રહેશ અકંપના, શૈવેશી શોધ. શ્રી સમ્મેત૦ ૩  
કર્મ અધાતી ઐરવી, અવિનાશી અનંત;  
અકુસમાન ગતિથી લહું, એક સમય લોકાંત. શ્રી સમ્મેત૦ ૪  
એકાંતિક આત્યાંતિકો, નિર્દ્દંદ મહાંત;  
અંયાણાધપણું વર્યા, કાળે સાહિ અનંત. શ્રી સમ્મેત૦ ૫  
સિદ્ધ બુદ્ધ તાત્ત્વિક દશા, નિજ શુણ આણુંદ;  
અચલ અમલ ઉત્સર્ગતા, પૂરણ શુણુંદ. શ્રી સમ્મેત૦ ૬

૧ પ્રશાસનીય થાય.

૨

એ તીરથ વંદન કર્યાં, સહુ સિદ્ધ વંદાય;  
 સિદ્ધાલંઘી ચેતના, શુણુસાધક થાય. શ્રી સમૈતો ૭  
 સાધકતા કરતાં થકાં, થાયે નિજ સિદ્ધિ;  
 દેવચંદ્ર પદ અનુભવે, તત્પવાનંદ સમૃદ્ધિ. શ્રી સમૈતો ૮  
**શ્રી નેડપલજિન (સિદ્ધાચળ)** સ્તવન. (રાગ ધન્યાશી)  
 આનંદ રંગ મળે રે આજ મારે, આનંદ રંગ મળે. (૨)  
 સમિતિ શુસી અંતરશું પ્રગટી, સુમતા સહજ ટળે. આજ મારે૦ ૧  
 જ્ઞાન નિધાન પ્રધાન પ્રકાશી, આતમ શક્તિ મળે;  
 તત્પરમણું નિજ સુખ સંપત્તિકે, અનુભવ રસ ઉછળે. આજ મારે૦ ૨  
 પરપરિષુદ્ધિ ગહન ધૂમશું, મોહ પિશાચ છળે;  
 શુદ્ધ સ્વરૂપ એકતા લીને, સખાહી હોષ દળે. આજ મારે૦ ૩  
 પ્રત્યાહાર ધારણા ધારી, ધ્યાન સમાધિ બળે;  
 સંયોગી નિજ શુણું રોધક, કર્મ પ્રસંગ ટળે. આજ મારે૦ ૪  
 સિદ્ધાચળમંડન પ્રભુ દીઠે, હમ લાયે સણળે;  
 દેવચંદ્ર પરમાત્મ દેખત, વંછિત સકળ ઝળે. આજ મારે૦ ૫  
**શ્રી સિદ્ધાચળ સ્તવન.** (સિદ્ધાચળગિરિ લેખા રે-એ ટ્યુ )

આજ અમ ધર હરખ ઉમાહેંદા, સકળ મનોરથ ઝૂળીએ;  
 શ્રી સિદ્ધાચળ તીરથ લેટે, લવ લવના હુઃખ ટળીએ. આજો ૧  
 શ્રી પરમાત્મ પ્રભુ પુરુષોત્તમ, જગત દિવાકર દીઠા;  
 તન મન લોચન અમૃતની પરે, લાગ્યા અતિહી મીઠા રે. આજો ૨  
 નેડપલ જિનેશ્વર પૂજયા લક્તે, મિથ્યા તિમિર હરવા;  
 શિવસુખ સંપત્તિ સકળ વરવા, નરભવ સફળ કરવા રે. આજો ૩  
 રાયણ તળે પ્રભુ પગલા વાંદ્યા, હુતર લવ જળ તરવા;  
 સકળ જિનેશ્વર ઠવણું અરચી, આણું મર્સ્તક ધરવા રે. આજો ૪

શિવા સોમળ ચૌમુખ ચૈત્યે, આદિનાથ જિનરાજા;  
 વંદી પૂજા લાડો લીધો, સાર્યો આતમ કાળ રે. આજ૦ ૫  
 એક શત આઠ દેહરી જિનવર, થાપન મહેતસવ કીધું;  
 સુરત લધુ શાખા ઓશવાલે, શાહ કર્મો યશ લીધું રે. આજ૦ ૬  
 લ્લવાશાહે સઈંહથ જિનવર, બિંબ પ્રતિષ્ઠા ધારી;  
 શાહ કપુર લાર્યો મીઠીએ, મોટી લાજ વધારી રે. આજ૦ ૭  
 સંવત સતત ષ્યાસી વર્ષો, જિનશાસન શોભાયે;  
 જિનવર બિંબ સ્થાપના હર્ષો, લાલ વિશેષ ઉપાયેરે. આજ૦ ૮  
 માહ માસ સુદિ પાંચમ દિવસે, ખરતર ગંગા સુખકારી;  
 પાછક દીપચંદ ગણ્ય કીધી, એહ પ્રતિષ્ઠા સારી રે. આજ૦ ૯  
 શ્રી શાનુંજ્ય ઉપર જિનવર, જે થાપે વિધિ ચુક્તે;  
 દેવચંદ્ર કહે ધન ધન તે નર, જે લીના જિન લક્તેરે. આજ૦ ૧૦

### શ્રી ન્રાઘલાજિન સ્તરવન.

( પંથડો નિહાળું રે ભીજા જિન તણો રે.-એ રાગ. )

ચાલો મોરી સહ્યાં। શ્રી વિમલાચર્યે રે, તિહાં શ્રી ન્રાઘલ જિણુંદ;  
 પૂર્વ નવાળું વાર સમોસર્યો રે, કેવળજ્ઞાન દિણુંદ. ચાલો ૧  
 શુદ્ધ તત્ત્વ રસીઆ બહુ સુનિવરુ રે, કીધ અનોગી લાવ;  
 તેહ સંભારી નમતાં નાપજે રે, નિર્મણ આત્મસ્વભાવ. ચાલો ૨  
 પાંચ કોડીથી માસી અણુસણે રે, શ્રી પુંડરીક સુનિરાય;  
 ચૈત્રી પુનમ સિદ્ધ થયા તિણે રે, પુંડરગિરિ કહેવાય. ચાલો ૩  
 વિધિશું જે સિદ્ધાચળ લેટશે રે, કરી ઉત્તમ પરિણામ;  
 નિયમા લંઘ કદ્યો તે જિનવરે રે, એ તીરથ અભિરામ. ચાલો ૪  
 સુર નર કિન્નર ગુણ ગાવે સુદા રે, પ્રથમે પ્રહસમ રીજ;  
 દેવચંદ્ર એ તીરથ સેવતાં રે, સકળ મનોરથ સીજ. ચાલો ૫

### શ્રી ન્રાઘલાજિન-સ્તરવન. ( રાગ-નોધપુરાની દેશી )

કંચન વરણું હો આદિ જિણુંદા, મારા લાવ હો આદિ જિણુંદા.

ત્રિલુલન તારક હો જ્ઞાન દિણુંદા માઠ લાઠ હો. જ્ઞાન દિણુંદા.  
 ચુશુણુ સોબાળી હો લોળી વરના માઠ લાઠ હોઠ  
 નિજ ગુણુ રમતા હો ત્યાળી પરના માઠ લાઠ હોઠ ૧  
 તુજ વિષુ દીઠે હો હું ભવ ભર્મીએ માઠ લાઠ હોઠ  
 કાળ અનંતે હો પરવશ ગર્મીએ માઠ લાઠ હોઠ  
 હવે પ્રલુ મળીએ હો તો હુઃખ ટળીએ માઠ લાઠ હોઠ  
 નિશ્ચય મારગ હો મેં અટકળીએ માઠ લાઠ હોઠ ૨  
 જિન ગુણુ શ્રદ્ધા હો ભાસન તુમચો માઠ લાઠ હોઠ  
 પ્રલુ ગુણુ રમણુ હો અનુભવ અમચો માઠ લાઠ હોઠ  
 શુદ્ધ સ્વરૂપી હો જિનવર ધ્યાને માઠ લાઠ હોઠ  
 આતમ ધ્યાને હો થઈ એકતાને માઠ લાઠ હોઠ ૩  
 પુષ્ટ નિમિત્તે હો એકતા રંગે માઠ લાઠ હોઠ  
 સહજ સમાધિ હો શક્તિ ઉમંગે માઠ લાઠ હોઠ  
 કારણુ નેણે હો કારજ થાયે માઠ લાઠ હોઠ  
 કારજ સિદ્ધે હો કારણુ ઠાયે માઠ લાઠ હોઠ ૪  
 તેણુ થિર ચિત્તે હો અરિહા ભજુએ માઠ લાઠ હોઠ  
 પરપરિણુતિની હો ચાલ તે તજુએ માઠ લાઠ હોઠ  
 અતિશય રાગે હો ભવસ્થિતિ પાકે માઠ લાઠ હોઠ  
 . સાધન શક્તે હો વિગતે થાકે માઠ લાઠ હોઠ ૫  
 નાલિનંદન હો શત્રુંય સોહે માઠ લાઠ હોઠ  
 જસુ પથ વંદી હો ગુણુ આરોહે માઠ લાઠ હોઠ  
 મુનિવર કોડી હો તિહાં સવિ પહેંતા માઠ લાઠ હોઠ  
 પરમ પ્રલુના હો ધ્યાનને ધરતા માઠ લાઠ હોઠ ૬  
 જિન ગુણુ ગાવા હો જે અતિ હષેં માઠ લાઠ હોઠ  
 પૂર્વાનંદ હો તે આકષેં માઠ લાઠ હોઠ

આતમ સત્તા હો જિનસમ પરએ માં લાં હોં  
 શાન્ત સુધારસ હો તે નિત વરષે માં લાં હોં ૭  
 એમ નિજ કારજ હો સાધન રસીઆ માં લાં હોં  
 જિનપદ સેવા હો ભક્તે ઉદ્ઘસીઆ માં લાં હોં  
 શક્તિ અનંતી હો વિગતે સાધે માં લાં હોં  
 દેવચંદ્રનો હો પદ આરાધે માં લાં હોં ૮

### શ્રી શાન્તુંજ્ય ચૈત્ય પરિપાઠી.

નમનિ અરિહંત પચણુંતશુણુ આગરા,  
 ખવિય કર્મમટુગા સિદ્ધ સુહસાગરા;  
 તીસ છગા (૩૬) ગુણુ જુ આધાર સૂરીસરા,  
 વાયગા ઉત્તમા નાણુ વાયણુધરા. ૧  
 વિષ સમા કામલોગાદિ સનિ પરિહરી,  
 શુદ્ધ શિવ સાધવા સાધના આદરી;  
 ઠાણુ એકાંત તિત્થાદિ સુચિ વાસિણો,  
 દુનિહ તપ સંગયા વંદિમો યતિગણો. ૨  
 જયવિ જગમાંહિ જિય ઠાણિ જિય ગુણુ લહે,  
 તેણુ થાનક લાણી તેહ ઉત્તમ કહે;  
 જગત ઉપગારી પરસિદ્ધ બહુ ગુણુ થવે,  
 મુનિ લાણી જિણુવરા સિદ્ધ કારણુ થવે. ૩  
 તીર્થકર કેવલી સુયધરા મુનિવરા,  
 ભાસએ તીર્થ જગમ તહા થાવરા;  
 જગમ તીર્થ પરસિદ્ધ ગુણુ ગણુ ભરા,  
 . તીર્થ થિર પંચ સુજનેહ જે અણુસરા. ૪  
 તેણુ વિમલાચદો તિત્થ ગુણુ આગરો,  
 મુનિ ગણુ સંશુચો ગરિમ ધીરમ ધરો;

રિસહ જિણુરાય બહુવાર જિહાં આવીયા,  
 પુંડરોકાદિ મુણિ સિદ્ધ પથ પાવીયા. ૫  
 વિમલગિરિ નામ ને અત્તિભરથી જવે,  
 સિદ્ધગિરિ દંસણ સુલહાઓહી હવે;  
 ઝાસણુા ( ગિરિ તણી ) કર્મ રય મોહણી,  
 સર્વમહંસણ પસુહ શુષુહ આરોહણી. ૬  
 તિથ સત્તાંજયો જિણુભવણ જુતાયો,  
 પુંષ બહુપુત્ર પળસારથી પતાયો;  
 ઠવણુ-જિણુ ભાવ-જિણુ લેદ નવિ આણીએ,  
 આણુ પથરોહણે કારણ જાણીએ. ૭  
 તેણુ આતસ તળુ તિથ સેવન કરો,  
 આશ્રમ પંક્થી આતમા ઉદ્ધરો;  
 ચૈર્ય વિણુયાદિકે નિજજરા ઉપદિસી,  
 દસમ અંગે વવહાર સુતે વસ્તી. ૮  
 સુદ્ધતા કારણું મોહ લડ વારણું,  
 દંસણ નાણ ઉજબાણ પડિઓહણું;  
 હીહ સંતાણું કર્મહું વિદ્ધસણું,  
 કુણુહ ભળવુતામા ! વિમલગિરિ દંસણું. ૯

દાણ. ૧. ચગણ કરણુધર મુનિવર વંદીયે-એ રાગ.  
 ભાવ ધરીને ચૈત્ય જુહારીએ, શ્રી સિદ્ધાચલ શૃંગે લુ;  
 જિન દંસણ પૂયણ ગુણ સંશુદ્ધ, કરો ભવિક મન રંગે લુ.

ભાવો ૧

પાલીતાણે રે ઋષલ જિનેશ્વરી, તીસ પ્રભુ લય ટાળે લુ;  
 ઋષલ ચરણ વંદો મનની રણી, લલિત સરોવર પાળે લુ.

ભાવો ૨

ગિરિવર મૂળે સુંદર વાવડી, જ્યાં ભવી અંગ પખાળે છું;  
તીર્થ વધાવી વંદીને ચઢે, આતમ ગુણુ ઉજવાળે છું.

લાખ૦ ૩

પાજે ચઢ ચઢ નેમી જિનેશ્વર, યાદવ કુળ આધારો છું;  
ચરણુ નભીને ગિરિવર ઉપરે, હરખ ધરીને પધારો છું.

લાખ૦ ૪

ઘોલી પરથે રે ભરહ ભરહવધી, ચરણુ નમું શુલ કામી છું;  
મહિલા સંગ થકાં પણુ મોહની, ખંડીને શિવ પામી છું.

લાખ૦ ૫

નેમી ચરણુ વંદીને પર્વતે, આરોહે આણુંદે છું;  
આદિનાથ પુંડરીક ગણુ તણુા, લવિયણુ પય ચુગ વંદે છું.

લાખ૦ ૬

ગિરિવર ચઢતાં રે મુનિવરને સમરે, ને સિદ્ધા ઈણુ તિત્થો છું;  
આતમ ઉદ્ધરવાને કારણે, પરમ પવિત્ર એ તિત્થો છું.

લાખ૦ ૭

અનુપમ દેહરા સુંદર અતિ લલા, સુરજકુંડ લીમ કુંડે છું;  
જિનવર દ્વાય ચરણુ જગનાથના, પ્રણભ્યાં પાતક ખંડે છું.

લાખ૦ ૮

લલખા નેલે રે શ્રી જિનવર નભી, ચેલણુ તલાઈ આણુંદે; છું.  
સિદ્ધશિલા તિહાં મુનિ નિજ શુલુ વરી, પાંચા પરમાનંદો છું.

લાખ૦ ૯

હરખ ધરીને સિદ્ધવડે વળી, સમરો સિદ્ધ મુણીનંદો છું;  
આદિપુરે જિનવર ચોવીસના, પ્રણભી પય અરવિનંદો છું.

લાખ૦ ૧૦

ઘોલીતાણે પાજ અનુક્રમે, આંદ્રા પોળ હુવારો છું;

વાધણુ ચોળે મંડપ ચૈત્યનો, દીઠો શુચિ દિદારો ૭.

ભાવો ૧૧

વાધણુ પ્રતિઓધી આચરને, ધધ કૃપાય વિહૃનો ૭;  
એ તીરથ ન તજે જે પાપને, તે તર્યારીથી દીનો ૭.

ભાવો ૧૨

હુનમંત ક્ષેત્રપાળ ચકેશ્વરી, જોમુખ કુવડ અંબાઈ ૭;  
આદિક શાસન સેવક દેવતા, ભક્તિવંત સુખદાઈ ૭.

ભાવો ૧૩

**ઢાળ ૨.** ( સહસ અમણુસું શુદ્ધ સંયમ ધરો-એ દેશી.)  
પ્રથમ પ્રવેશો રે નેમી જિનેશ્વરુ, ચૈહ્ય સુંદર અતિહી સુહુંકર;  
જિનવર બિંબ પરમ શામ કારણું, તીન સય સોણ નમો હુઃખ વારણું.  
નુટક-હુઃખ વારણુા જિનબિંબ નમતાં, હોય સમકિત સેહિલો,  
સમતા સુધારસ કુંડ જિનવર, દેવ દર્શન દોહિલો;  
જ્યાં ચૈત્ય મંગળ તાસ છ ગજ ભરતશાહ મંડાવીએ;  
હુઃખ હેતુ પરિથહ સકલ જાણી, શુદ્ધ ક્ષેત્ર એ વાવીએ. ૧  
જિનવર ચૈત્ય જુગલ તસુ આગળે, અરિહા તીન નમો અતિ મંગળે;  
જયમલશાહ તણોા ચૌમુખ વર, શ્રી પુરુષોત્તમ સોલમ સુહુંકર.  
નુટક-સુહુંકર શ્રી કુંશુ જિનવર, તેમ ચંદ્રપ્રલુ તણોા,  
જિનરાજ બિંબ ધર્મયાર મંડિત, પરમ શુચિ સિદ્ધાયણો;  
શ્રેયાંસ તેમ શ્રી શાંતિ જિનવર, ચૈત્ય યુગલ સોહામણુા,  
ઈગતીસ બિંબ જુહારી લક્તે, પવિત્ર થાએ ભવિયણુ ! ૨  
સ(લ)દ્ધા વોહરા કારિત દેહરો, દેહરી સુંદર મંડિત સેહરે;  
મૂળ ગલારે ઋપલ જિનેશ્વર, બત્તીસ બિંબ નમો સમતાધર.  
નુટક-સમતાધર જિનરાજ નમતાં, કર્મ કલંક ગળે ધણો,  
અતિ શુદ્ધ નિર્મણ પરમ અક્ષય, રૂપ પ્રગટે આપણુા;

શ્રી વીતરાગ પ્રશાંત મુદ્રા, દેખતાં જો સાંલદે;  
 નિજ શુદ્ધ સાધ્ય એકત્વ કરતાં, આત્મ સાધકતા વરે. ૩  
 વળી પ્રવેશો રે જિમણી શ્રેણિમેં, સમવસરણું શ્રી વીરતણો નમે;  
 પાસ વિહાર ભાંડારી કૃત થયો, કુંઘુનાથ ચૈત્ય જિન શુણું થવો.  
 તુટક-ગુણું થવો લક્તે એહ થાપ્યા, ચૈત્ય તીન સુહામણ્ણા,  
 ઉવાયવર શ્રી દીપચંદ્રે, ગર્ભ અરતર શુણું ધણ્ણા;  
 તિહાં ચૈત્ય એક પ્રસિદ્ધ સુંદર, કુંઘુનાથ જિણુંદનો,  
 અતિ લક્તે જુગતે નમે પૂજે, લવિ મન આણુંદણો. ૪  
 મોટો ગઠ શ્રી કરમાશાહનો, સોલમ વાર ઉદ્ધાર એ નાહનો;  
 બોલે શ્રી પુંડરીક મુનિવરુ, પંચ કોડીથી સિદ્ધા ધણું ગિરુ.  
 તુટક-ધણું ગિરે સિદ્ધા ચૈત્રી પુનમ, શુક્લ ધ્યાનને ધ્યાવતા,  
 તસુ ચૈત્ય જિણું વિસ સગહિય, વંદિયે મન ભાવતા;  
 તસુ બાધ્ય લમતી દેહરી શત, ચાર અધિકી દીસએ,  
 જિણુંબિંબ ત્રણુસેં અહિય સડસઠ, મણુમતાં મન હીસએ. ૫  
 દીજે બીજુ વાર પ્રદક્ષિણા, સંધવી ચૈત્ય કરો જિન વંદના;  
 બીકાનેરી સતીદાસનો ચેદ્ધય અતિ ઉત્તંગ સુવાસનો.  
 તુટક-આસને ચૈત્રે પંચ જિનવર, મૂળનાયક સોહણ્ણા,  
 તેતીસ મુદ્રા સિદ્ધાળી, લવિક મન પડિયોહણ્ણા;  
 સંધવી ગોતે નામ પાંચો, દેહરી પણું તસુ કરી,  
 જિનબિંબ એક ચૌમુખ મુદ્રા, સોળ થાપી અતિ ખરી. ૬  
 દેહરી જિન માતાની સુંદરો, ઉચ્છંગે જિનરાજ દ્યાવરુ;  
 શ્રી સિદ્ધાચલ ચૈત્ય પ્રકાશથી, જિનવર ચાર નમો ઉદ્ઘાસથી.  
 તુટક-ઉદ્ઘાસથી શ્રી વિજ્યતિલકે, શાસનાધિપ જિનવરુ,  
 શ્રી વીરનાથ અનાથ નાથાં, વંદિયે અતિ સુંદરુ;  
 જગહીસ તીસ નિરીહ નિર્મભ, નમો ધરી અથેદતા,

મિથ્યાત્વ આદિક ભ્રમણ હેતુ, મૂળથી ઉચ્છેદતા. ૭  
સહસ્રકૂટ નમો ધરી લાવના, તીન કાળના રે જિનની થાપના;  
મેઘખાઇની દેહરી વંદિયે, જિનવર તીન નમી આણુંદિયે.  
તુટક-આણુંદિયે ચોમુખ જિન, ચોતીસ પૂઠલ મનરમો,

શ્રી દીવ સંધ વિહાર જિનવર, બિંબ છતીસે નમો;

ધહાં અછે ભૂંહરો તિહાં જિનવર, સમર સારંગ થાપના,

વળી મૂળગ વસહી નેમિ જિનવર, બિંબ નમિયે નિઃપાપના ૮

શ્રી અષ્ટાપદ જિન ચોવીસ એ, બિંબ અહૂાવન સુંદર દીસ એ;

કીધો બાઈ ગુલાલ વિહાર એ, શ્રી સર્મેતશિખર સુખકાર એ.

તુટક-સુખકાર સાર વિહાર સુંદર, કર્મ લાર નિવારણો;

શ્રી અજિતાદિક વીસ જિનવર, સિદ્ધક્ષેત્ર સુહામળો.

જિહાં વીસ જિનવર સિદ્ધ ઠવણો, ચરણ વળી જિન હેવના;

વંહિયે લવિયણુ ! ધણ્ણે હરાયે, કીળુએ શુચિ સેવના. ૯

સમવસરણ જિનરાજ વિકાશતા, ચૌમુખ રૂપે રે દેહરા શાસતા;

સોની તિલકતણો ચૌમુખ વરુ, ચૌમુખ દસ સૂરતના સુંદરો.

તુટક-સુંદર દેહરી દોય જિનવર, બિંબ ચાર સોહામણો;

શ્રી રૂંખ રાયણ જગપ્રસિદ્ધો, લીળુએ તસુ લામણો.

તસુ તળે પગલાં ઋષભ જિનના, વંદતાં લવ લય હરે;

વીતરાગ ભાવે નાગ મોરી, તજ વેર તિહાં ઠરે. ૧૦

દેહરો એક ચોવીશી આવતી, પંચાવન જિનબિંબ સુહાવતી;

ચોદહ સેં ભાવન ગણુધાર એ, જિન ચોવીસે ચરણ સુખકાર એ.

તુટક-સુખકાર ચૈત્ય સમાન વસહી, બિંબ સગ ચૌમુખ વલી;

દેહરી અમૃતખાઇએ તિહાં, શાન્તિ સુદ્રા અતિ લદી.

વલી શેઠ લક્ષ્મીચંદ શાંતિદાસ કીધી દેહરી;

જિનરાજ તીન જુહારતાં, મન ભાંતિ કરમલતા હરી. ૧૧

ગામ ગંધારે દે રામજી શેડનો, ચૌમુખ સુંદર શ્રી પરમેષ્ઠિનો; તીજી લમતી દેહરી ચિયાલ (૪૦) એ, પણ રથય બિંબ તિહાં અડયાલ એ. તુટક-અડયાલ અહિયા એકસે તિહાં, બિંબ તીર્થંકર તણુા;

તિહાં મૂળ દેહરે ઋષલ જિનવર, તરણુ તારણુ કારણુ.

જિન બિંબ સત્તાવીસ મંડપ, ગંધારે છતીસ એ;

જિનચંદ નાલિનરેંદ્ર નંદન, દેખતાં મન હોસ એ. ૧૨  
જન્મ સઙ્કલ એ કરમાશાહનોા, જેણે ચૈત્ય કર્યો બહુ લાહનોા;  
ગજ જુગ ખંધે દે મરુદેવી મુદા, ચક્કી લરહ કરે સેવન સદા,  
તુટક-સેવના કરતાં શુદ્ધ નિર્મણ, આત્મ સંપત્તિ પામીયે;

સતુંજ તીરથનાથ ઉસલો, દેખી પાતક વામીયે,  
તસુ જન્મ સઙ્કલો સિદ્ધક્ષેત્રે, જેણે જિનવર લેટીયા;

ચિરકાળ હુદ્ધમન કર્મ સઘળા, તેહના લય મેટીઆ. ૧૩

ત્રણુસેં બિંબ તે મંગળ ચૈત્યના પ્રણુમો પ્રહ સમે જાહી નિત્યના;  
આશય દોષ આસાતના વારતાં, લાલ અનંતો ચૈત્ય જુહારતાં.

તુટક-જુહારતાં જિનરાજ પડિમા, વળો તીરથ જીપરે,  
તે વળો વિમળગિરીંદ ઉપર, લાલ દેખો કુણુ કરે?;

તિહાં કોડિમુનિ પરલાવ પરિણુતિ, ત્યાગી આત્મ ગુણુ વર્યુ,  
નિજ શુદ્ધ ધ્યાને શુદ્ધ જ્ઞાને, સિદ્ધતા પદ અનુસર્યુ. ૧૪

બીજે શૃંગે દે કુંતાસર અછે, એક શુંભ પણ જિણુ પિણુ તીસ છે;  
અદખદ ચૈધ્ય ઋષલ જિનેશ્વર, મોટી કાય જગ વિસ્મયકર.

તુટક-વિસ્મયકર શ્રી અજિત ચૈધ્ય, કુંડ જુગલ રણિયામણુા,  
તિહાં કુસુમવાડીમાંહે ગોયમ, ચરણુ વંદો શુભ મના;

તસુ આગલે અડ લુણુ ચૈધ્ય, તિહાં દેવ જુહારીયે,  
અતિ હુર્ષ ધરતાં પોળ દ્વારે, ચૌમુખમાંહે પધારીયે. ૧૫

પોળે શ્રી નમિ જિનવર દેહરો, બિંબ સત્તાવન નમી લખ લય હુરો;

આહર ભમતી દેહરી સુખકર, એકસો આડ અતિ હી મનોહર. તુટક-મનોહર જિનવર બિંંબ એકસય, દોય એઠા એસશે,  
 છત્તીસ મંગળ ચૈત્ય ધગ સય, સોળ લવિજન મન ધસે;  
 શિવા સોમણ સુત રતનાઙ્કૃત, શાંતિ દેવ પ્રાસાદમે,  
 પંચાસ જિનવર શુદ્ધ સુદ્રા, નમો ભવી આદહાદમે. ૧૬  
 દેહરે સુવિધિજિનેશ્વરને લલો, પાર્વિનાથજિન ચૈત્ય તે નિર્મલે;  
 સુદ્રા નવ જિનદાસ્સૂરીશ્વર, કુશલસ્સૂરીશ્વર ખરતર ગણુવર.  
 તુટક-ગણુવર દેહરી સિદ્ધયકની, શાહ લાલ વિહાર એ,  
 જિણુબિંબ સત્તર ચાર અધિકા, કરે લવિ નિસ્તાર એ;  
 દેહરે સુમતિ જિણુંદ કેરો, શાહ ઠાકુર ઉદ્ધયો,  
 જિનબિંબ સય ગણુધાર મંડપ, દેખતાં સુજ મન ઠર્યો. ૧૭  
 પગલાં તિહાં ચોવીસ જિણુંદના, ચૌહેસેં ણાવન ગણુવૃંદના;  
 જેસલમેરી જિનદા થાહર, તસુ કૃત પીઠ પછે અતિ સુંદર.  
 તુકટ-સુંદર રાયણ ઢંખ પાસે, ઝષલ જિણુ પય વંદીયે,  
 દેહરી તીન ઉતુંગ દેખી ચિત્તમેં આણુંદીયે;  
 શ્રી અજિતનાથ વિહાર જિન નવ, દોય ગણુવર થાપના,  
 ગોમુખ ને ચહેશરી તિહાં, લક્ષ્માજનને આસના. ૧૮  
 સૂરજ શાહનો શાંતિ વિહાર એ, જિનવર દોય તિહાં સુખકાર એ;  
 ભમતી તીળ ચૌમુખ માંહેલી, જિનસુદ્રા અડયાલ છે નિર્મળી.  
 તુટક-નિર્મળી સુદ્રા તીર્થપતિની, તિહાં સંઘવી સોમળ,  
 કર જોડી જોલો તીર્થસેવા, યાચના યાચે અણ;  
 ચૌમુખ સુંદર ચાર જિનવર ઝષલદેવ જિણુંદના,  
 પ્રહસમે જાઠી લક્ષ્મા ચિત્તે, કરો નિત પ્રતિ વંદના. ૧૯  
 સમતા સાગર જિનવર દેખીયે, જન્મ સક્રાણ એહીજ મન લેખીયે;  
 અરિહંત સુદ્રા દીઠાં આપણી, સાધક શક્તિ વધે લવ કાપણી.

નુટક-કાપણી પાતક પૂર્વકૃત એ, તીર્થસેવા સારીયે,  
 શુચિ કારણે નિજ શુદ્ધ શુચિતા, ભાવ નિયમા ધારીયે;  
 ઉદ્ધાર અદૂમ સોમજી સુત, રૂપળ સંધવી કર્યો,  
 ભવ પંક ખૂતો હીર્ઘકાલી, આતમા એમ ઉદ્ધર્યો. ૨૦  
 ધીલુ ભૂમે દેહરે ઉપરે, ચોવીસ દેહરી ચોવીસ જિનવરે;  
 ધીલા જિન ચોવીસ તિહાં અછે, ચૌમુખ એક ગંભારે મધ્ય છે.  
 નુટક-મધ્ય એ ચૌમુખ તુંગ ચેદ્ધય, જોખ ધ્વજ કલશો કરી,  
 શોભતો સમકિત હેતુ ભવિને, દેખતાં ચક્ષુ ઠરી;  
 શ્રી શાંતિનાથ વિહાર સુંદર, રાય સંપ્રતિ ઉદ્ધર્યો,  
 જિન બિંબ અડ ચુત શાંતિ જિનવર, દેખ્યો મન હર્ષ વર્યો. ૨૧  
 તીર્થનાથ વિમલગિરિ ઝર્સાના, કરીએ ભવિય ધરી શુચિ વાસના;  
 મુનિવર ડોડી અનંતા શિવ લહે, તે સંભાર્યાં આતમ ગહુગહે.  
 નુટક-ગહુગહે આતમ સિદ્ધશૈંત્રે, તેહ સાધક પદ વરે,  
 નિજ શુદ્ધ પૂરણ ચેતના, ધન ભાવ અક્ષય અનુસરે;  
 જિહાં અછે સુક્રખ અત્યંત નિર્મળ, આતમ પરિણામિકપણે,  
 અવિનાશી સત્તા સહજ ભાવે, તાસુ ગુણ છિય (?) કુણ ગિણે. ૨૨

ઢાળ ઉ. ( ભરત નૃપ ભાવસું એ-એ દેશી. )

શત્રુંજય ગિરિ લેટીયે એ, મેટીયે કર્મ કલેશ;  
 મિથ્યા હોષ નિવારવા એ, ધારો સમકિત દેશ. શત્રું૦ ૧  
 કાળ અનાદિ ભવોદધિ એ, ભમતાં ભવ સમુદ્દાય;  
 યાનપાત્ર સમ જાણુને એ, એહી જ તીરથરાય. શત્રું૦ ૨  
 માનવ ભવ પાભી કરી એ, એ તીરથ શુણુગેહ;  
 જે નવિ લેટચો ચુક્લિશું એ, તે હુભિયામેં રૈહ. શત્રું૦ ૩  
 ઈહાં સિદ્ધા પણ (૫) ડોડીસું એ, ગાણુધર શ્રી પુંડરીક;  
 ચૈત્ર શુક્લ પુનમ દિને એ, નિજ સત્તા ગુણ ઠીક. શત્રું૦ ૪

ક્રાગણ સુદિ સાતમ લખ્યું એ, નમિ વિનમી શિવથાન;  
 ચોસઠ નમિ પુત્રી તસુ એ, આડમે ડેવળજ્ઞાન. શત્રું૦ ૫  
 સાગર મુનિ ત્રણુ કોડિથી એ, કોડિથી મુનિ શ્રી સાર;  
 તેર કોડિથી શિવ વર્યા એ, સોમશ્રી અણુગાર. શત્રું૦ ૬  
 ઋષલ વંશ આદિતજ્ઞા એ, તસુ સુત આદિત્યકાંતિ;  
 એક લાખ પરિવારશું એ, પામ્યા પરમ પ્રશાંતિ. શત્રું૦ ૭  
 ઋષલ વંશ મુનિવર બહુ એ, ગણુધર કોડિ અસંખ;  
 શિવ પહેંતા સિદ્ધાચલે એ, નિર્મભ ને નિરકંણ. શત્રું૦ ૮  
 દસ કોડિથી શિવ લખ્યું એ, દ્રાવિડ ને વારિભિદ્ધ;  
 ચૌદ સહસ નિર્થથથી એ, દમિતારી નિઃસંદ્ર. શત્રું૦ ૯  
 આદિનાથ ઉપગારથી એ, કોડિ સત્તર અણુગાર;  
 શ્રી જિતસેન મુનીશ્વરુ એ, પામ્યા સુક્રખ અપાર. શત્રું૦ ૧૦  
 આનંદ રક્ષિત ભાવના એ, ભાવતાં શિવપુર પતા;  
 કાલાસી એક સહસથી એ, મુનિ સમુદ્ર સય સત. શત્રું૦ ૧૧  
 રામચંદ્ર પણુ કોડિથી એ, નારદ મુનિ પિસ્તાલ;  
 પાંડવ કોડિ વીસથી એ, શિવ પહેંતા સમકાલ. શત્રું૦ ૧૨  
 સંખ પજન્તુજ્ઞ મુનીશ્વરુ એ, મુનિ સાઢા ત્રણુ કોડિ;  
 વિમલાચલે નિર્મલ થથા એ, તે પ્રણુમું એ કર જોડ. શત્રું૦ ૧૩  
 થાવચ્ચાસુત શુક મુનિ એ, સેલગ પંથગ સિદ્ધ;  
 વસુદેવ ધરણી શિવ લખ્યું એ, સહસ પેંતીસ પ્રખુર્દ. શત્રું૦ ૧૪  
 વૈદ્યકી નિઃકર્મતા એ, સ્વામી સલ (?) ચોક્કાલ;  
 શ્રી વસ્સસાર (?) અનંતતા એ, પામી શુણુ સંભાલ. શત્રું૦ ૧૫  
 સિદ્ધા બહુ મુનિ ધણુ ગિરિવરે એ, યાદવ વંશ અનેક;  
 અણુક કુલ સાધુ સાધવી એ, સિદ્ધ લદ્યા થિર ટેક. શત્રું૦ ૧૬  
 વિદ્યાધર ભૂચર ધણુ એ, ધહાં પામ્યા શુણુ કોડિ;

આતમ હેતે એહની એ, કો ન કરી શકે હોડી. શત્રું ૧૭  
તિવારે તીરથપતિ એ, એ તીરથ બહુવાર;  
આંયા લવિજન તારવા એ, નિર્મભ નિરહંકાર. શત્રું ૧૮  
પુંડરગિરિની સેવના એ, જેહ કરે ભવિ જીવ;  
તે આતમ નિર્મળ કરી એ, પામે સુક્રખ સહીવ. શત્રું ૧૯  
એ ગિરિરાજને સેવતાં એ, દેવચંદ્ર પદ સાર;  
લવોલવ તીરથ સેવના એ, હોણે પરમ આધાર. શત્રું ૨૦

### કૃણશ

એમ સકળ તીરથનાથ શત્રુંજ શિખરમંડળુ જિણુવરો,  
શ્રી નાલિનંદન જગ આનંદન, વિમલ શિવસુખ આગરો;  
શુચિપૂર્ણ ચિહ્નધન જ્ઞાન દર્શન, સિદ્ધ ઉદ્ઘોતન મને,  
નિજ આત્મસત્તા શુદ્ધ કરવા, વીર જિન કેવલદિને. ૧  
સુવિહિત ખરતર ગચ્છ શ્રી જિનચંદ્રસૂરિ શુણુનીલો,  
ઉવાય વર શ્રી રાજસારહ શિષ્ય પાઠક શિર તિલો;  
શ્રી જ્ઞાનધંમ સુશિષ્ય પાઠક, રાજહંસ શુણે વરો,  
તસુ ચરણ સેવક દેવચંદ્રે, વીનંદ્યો જગ હિતકરો. ૨

### પાંચ પાંડવની સજાય

જીહેં પાંચ પાંડવ સુનિરાય, આરોહેં શત્રુંજયગિરે હો લાલ;  
જીહેં પૂરવ સિદ્ધ અનંત, તેહનાં શુણુ મનમેં ધરે હો લાલ. ૧  
જીહેં ધન્ય શ્રમણ નિર્થંથ, જિણુ નિજ આતમ તારીયે હો લાલ;  
જીહેં દર્શન જ્ઞાન ચારિત્ર, આતમ ધર્મ સંભારીયે હો લાલ. ૨  
જીહેં પામી ગિરિવર એહ, સૂધું અણુસણુ આદરી હો લાલ;  
જીહેં કર્મ કદર્થન ભાંળ, નિજ અસંગતા અનુસરી હો લાલ. ૩  
જીહેં પ્રણુભી આદિ જિણુંંદ, આણુંદે વંદન કરે હો લાલ;  
જીહેં તે મન ચિંતે એમ, આત્મખળે લવલય હુરે હો લાલ. ૪

જીણા ગિરિ ઉપરે એકંત, પુઢવી શિલાપટ પૂંળને હો લાલ;  
 જીણા ધર્માચાર્ય શ્રી નેમિ, વંદે નિરમળ ડેજ મેં હો લાલ. ૫  
 જીણા સિદ્ધ સકળ પણુમેવિ, આચાર્ય પમુહા ગુણી હો લાલ;  
 જીણા જીવ સકળ ખામેવિ, વર્તુધર્મ સમ્બદ્ધ સુણી હો લાલ. ૬  
 જીણા પાપસ્થાન અઠાર, દ્રોય ભાવથી વોસરી હો લાલ;  
 જીણા પૂરવ મત પરિમાણુ, વળી ત્રિકરણુથી ઉચ્ચરી હો લાલ. ૭  
 જીણા ઈષ કંત અભિરામ, ધીર શરીરને વોસિરે હો લાલ;  
 જીણા પચ્ચયખ્યા ચાર આહાર, પાદ્ય પરે અણુસણુ કરે હો લાલ. ૮  
 જીણા લેદ રત્નત્રયી રીતિ, સાધન જે મુનિને હતો હો લાલ;  
 જીણા તેછ અલેદ સ્વભાવ, ધ્યાન બળે કીધો છતો હો લાલ. ૯  
 જીણા તત્ત્વરમણુ એકત્વ, રમતા સમતા તન્મયી હો લાલ;  
 જીણા પંચ અપૂરવ જોગ, કર્મ સ્થિતિ ભાગી ગઈ હો લાલ. ૧૦  
 જીણા અશ્વસમી કરણેણુ, કર્મપ્રદેશો અનુસંધા હો લાલ;  
 જીણા કિંદીકરણુ મોહ, ચૂરણુ કરી નિર્મળ છીંયા હો લાલ. ૧૧  
 જીણા ક્ષીણુમોહ પરિણામ, ધ્યાન શુકલ બીજે ધરે હો લાલ;  
 જીણા પ્રીતિ ક્ષય લયલીન, કેવળજ્ઞાન દશા વરે હો લાલ. ૧૨  
 જીણા થયા અનોગી અસંગ, શૈલેશી ઘનતા લહી હો લાલ;  
 જીણા અવ્યાખાધ સ્વરૂપ, સકળ પૂર્ણપદ સંથહી હો લાલ. ૧૩  
 જીણા સિદ્ધ થયા મુનિરાજ, કાજ સંપૂરણ નીપનો હો લાલ;  
 જીણા શુદ્ધાનંદ ગુણ લોગ, અક્ષય અખાધ સંપનો હો લાલ. ૧૪  
 જીણા નાણુ દંસણ સંપજ્ઞ, અશરીર અવિનશ્યરુ હો લાલ;  
 જીણા ચિદાનંદ લગવાન, સાદિ અનંત દશા ધરુ હો લાલ. ૧૫  
 જીણા વીસ કોડિ સુનિરાય, સિદ્ધ થયા શત્રુંજ્યગિરે હો લાલ;  
 જીણા તે કાલે ‘જ્ય’ સાધુ, કોડી તીનથી શિવ વરે હો લાલ. ૧૬  
 જીણા નારદ મુનિ લહી સિદ્ધિ, સાધુ એકાણ લાખથી હો લાલ;

જીહો ભાંખ્યો એ અધિકાર, શત્રું જ્ય મહાતમ્યમાંહિથી હો લાલ. ૧૭  
 જીહો એહવા સંયમ ધાર, પાર લદ્યો સંસારનો હો લાલ;  
 જીહો વંદો સવિ નરનાર, શ્રમણુ સુગુણુ ભંડારનો હો લાલ. ૧૮  
 જીહો પાઠક શ્રી દીપચંદ્ર, શિષ્ય ગણ્ય એમ મંગલે હો લાલ;  
 જીહો વંદે મુનિ દેવચંદ્ર, સિદ્ધા ને સિદ્ધાચલે હો લાલ. ૧૯

### પાચી-ગણુધર-સન્જાય.

પાસ જિનેધર દેવના લુ, ગણુધર દસ ગુણુખાણ;  
 કદ્વપસૂત્રમેં અડ કદ્યા લુ, તે કારણુ વસે જાણ.

ચતુર નર ! વંદો ગણુધર સ્વામ. ૧

પહેલો ગણુધર પાસનો લુ, શુલ નામે શુલ ધાર;  
 આયુદોષ બીજો સ્તવું લુ, તીય વશિષ્ટ ઉદ્ધાર. ચતુર૦ ૨  
 અધ્યાત્મારી ચોથો નમું લુ, પંચમ સોમ સન્દૂર;  
 છુટો શ્રી હરિ સાતમો લુ, વીરભદ્ર ગુણુ ભૂર. ચતુર૦ ૩  
 સૂરિ શિરેમણી આઠમો લુ, 'જસ' નામે પરધાન;  
 આવરથક નિર્યુક્તિથી લુ, જ્ય તેમ વિજય નિધાન. ચતુર૦ ૪  
 દ્વાદશ અંગધરુ સહુ લુ, સહુ પહેંતા નિરવાણ;  
 દેવચંદ્ર ગુરુ તત્ત્વના લુ, સેવો ચતુર સુભાણ. ચતુર૦ ૫  
 ૧. દ્વાદશાંગી સન્જાય ( અનુત્તિજિન તારનેર-એ દેશી )  
 હવે નવિ તજનો રે, વીર ચરણ અરવિંદ;

સદા તુમે લજનો રે, જિનવર ગુણુ મકરંદ. ( આંકડો૦ )  
 શ્રી ઈંદ્રભૂતિ ગણુધર એમ ભાંખે, સાંભળનો તુમે ભાઇ !;  
 વાદ મિસે પણ ધણુ દિશિ આવ્યા, પામ્યા મોક્ષ સનાર્દ. હવે૦ ૧  
 ભ્રાંતિ ટળી મુજ મનની સઘળી, અનુભવ અમૃત પીધો;  
 વીતરાગ પણ કરુણા રીતે, મુજને તેડો લીધો. હવે૦ ૨

વાકે કર્યું જે તુમ ઈહાં આયા, ત્રિલુલનપતિ ગુરુ દીઠો; ચંગતિ ભ્રમણુ તણો ભય વાર્યો, પાપ તાપ સવિ નીઠો. હવે૦ ૩ અભિભૂતિ પમુહા એમ ચિંતે, લાવ ચિંતામણુ લાધો; એહની સેવ કરી ઉદ્ઘાસે, નિજ પરમારથ સાધો. હવે૦ ૪ કર જોડી વંહી એમ ભાંખો, પ્રલુ સામાયિક આપો; સર્વ અસંયમ ફૂર નિવારી, અમને સેવક થાપો. હવે૦ ૫ સામાયિક પ્રલુમુખ્યી પામી, સંયત લાવે આયા; ઈદ્રાદિક અનુમોદન કરતા, ઈદ્રાણી ગુણુ ગાયા. હવે૦ ૬ તત્ત્વપ્રકાશ કરો જગનાયક !, કર જોડી સવિ માળો; તત્ત્વપ્રકાશક ત્રિપદી આપી, કરુણાનિધિ વીતરાળો. હવે૦ ૭ વીર વચન દિનકર કર ક્રરસે, જ્ઞાન કમળ વિકસાણો; જીવ અળુવાદિકનો સધળો, વજ્ઞાન્ય લાવ જણાણો. હવે૦ ૮ દ્વારા અંગ રચ્યા તિણુ અવસર, વાસક્ષેપ પ્રલુ કીધો; ચંગિહ સંધ તણો અધિકારી, શ્રી ગણુધર પદ દીધો. હવે૦ ૯ ત્રિશલાનંદન સેવન કરતાં, નિજ રત્નત્રયી ગહીયે; આત્મ સ્વલાવ સકળ શુચિ કરવા, દેવચંદ્ર પદ લહીયે. હવે૦૧૦

૨૦. ( પંચમી તપ તુમે કરો રૈ પ્રાણી-એ ૬૫ )

વીર જિનેશ્વર જગ ઉપગારી, ભાંખે ત્રિપદી સાર રૈ; ગણુધરબોધ વધ્યો અતિ નિર્મળ, પસર્યો શ્રુત વિસ્તાર રૈ. વીર૦ ૧ દિલ્લિવાદ અધ્યયન પ્રકાશ્યા, પરિકર્મા સ્કૂત અનુયોગ રૈ; પૂર્વ અનુયોગ પૂર્વગત પંચમ, ચૂલિકા શુદ્ધ ઉપયોગ રૈ. વીર૦ ૨ વસ્તુ સત્કાર સુવિધિનો દેશન, કારણુ કાર્ય પ્રપંચ રૈ; પૂર્વગત નામે વિસ્તાર્યો, ચોથો બહુ ગુણુ સંચ રૈ. વીર૦ ૩ પ્રથમ પૂર્વ ઉત્પાદ પ્રરૂપ્યો, અથાયણી દ્વિતીય રૈ; વીર્ય પ્રવાહને અસ્તિ પ્રવાહ એ, જ્ઞાનપ્રવાહ અમેય રૈ. વીર૦ ૪

सत्यप्रवाद ने आत्मप्रवादनो, कर्मप्रवाद पड़र दे;  
 प्रत्याख्यान विधा सुप्रवादन, कृत्याणु नाम सनूर दे. वीर० ५  
 प्राणुवाया किया सुविशालह, सुगुण लोक भिंहुसारं दे;  
 प्रथम कृद्या गणुधर तेषु पूरव, नाम थयो सुभकार दे. वीर० ६  
 गहन अर्थ भाषा अति संकृत, समजे अति भतिवंत दे;  
 तेषु श्री संघे विन०या गणुधर, सुगम प्रकाशो संत ! दे. वीर० ७  
 जगत दयाण आचारञ्ज ऐत्या, अंग ईग्यार निधान दे;  
 आचारांगे आचार माक्षनो, द३०य भाव सुप्रधान दे. वीर० ८  
 सूयगांगे तत्वनो शोधक, ठाणुंगे दस ठाणु दे;  
 संभवायांगे ऐल विविध छे, आगमनो भंडाणु दे. वीर० ९  
 विवाहपञ्चती नाम लगवती, अति गंभीर उदार दे;  
 शाताधर्मकथा मुनिचर्या, उपासकदशा विचार दे. वीर० १०  
 अंतगडदशा अनुत्तरोववाई—दशा प्रक्ष०याकरणु दे;  
 सूत्र विपाक ए अंग ईग्यारे, गूच्या अर्थ सुवरणु दे. वीर० ११  
 अर्द्धभागधी भाषा भनोहर, सवी जनने हितकार दे;  
 गणुधर वचन ते अंग कहीने, शेष पयना सार दे. वीर० १२  
 ए जिन आगम अति उपगारी, डेवलज्ञान निदान दे;  
 अक्षयासो मुनि आत्म हेतो, निर्मल समता थान दे. वीर० १३  
 श्रुत सज्जाये जिनपद लहिये, थाये तत्वनी शोध दे;  
 देवव्यांद्र आणुये सेवा, जेम लडो शुद्ध प्रभोध दे. वीर० १४  
 लगवती सूत्र सज्जाय. ( सांलणने मुनि संज्ञ रागे—ए ८५ )  
 श्री सोहम जंगुने भाषे, सांख्यने लवि प्राणी दे;  
 गौतम पूछे वीर प्रकाशो, भधुरी सुभकर वाणी दे. श्री० १  
 सूत्र लगवती प्रक्ष अनुपम, सहस छत्रीस वभाष्या दे;  
 दश हुबर उदेशा भंडित, शतक एकतात्र प्रभाष्या दे. श्री० २

ખંડક આદિક મુનિવર સુવિહિત, શ્રાવક પ્રક્ષ અનેક રે;  
 ધર્મ યથારથ લાવ પ્રરૂપ્યા, શ્રી ગણુધર સુવિવેક રે. શ્રી૦ ૩  
 સંવેગી સંદુગુરુ કૃતચોણી, ગીતારથ શુત ધાર રે;  
 તસુ સુખ શુદ્ધ પરંપર સુણુતાં, થાવે લવ નિસ્તાર રે. શ્રી૦ ૪  
 ગૌતમ નામે પૂજન વંદન, શુંહણી ગીત સુલભ્ય રે;  
 શુત બહુમાને પાતક છીને, લહિયે શિવસુખ નવ્ય રે. શ્રી૦ ૫  
 મન વચ કાય એકાન્તે હુરાયે, સુણીયે સૂત્ર ઉદ્ઘાસ રે;  
 ગારૂડ મંત્રે જેમ વિષ નાશે, તેમ તૂટે લવ પાસ રે. શ્રી૦ ૬  
 જ્યકુંજર એ શ્રી જિનવરનો, જ્ઞાનરત્ન લંડાર રે;  
 આતમ તત્ત્વ પ્રકાશન રવિ એ, એ મુનિજન આધાર રે. શ્રી૦ ૭  
 સાંભળશો વિધિથી સૂત્ર જે, લણુશો ગુણુશો જેહ રે;  
 દૈવચંદ્ર આણુથી લહેશો, પરમાનંદ સુખ તેહ રે. શ્રી૦ ૮

**શુંહણી.** ( સ્વામી સીમંધરા ! વીનતિ-એ દેશી )

શાસનનાયક વીરનો, ગણુધર ગૌતમસ્વામ રે;  
 શીલશિરેમણી તેહનો, શિષ્ય જંખુ અભિરામ રે. શા૦ ૧  
 વીર જિન વચન ત્રિપદી લહી, જેણે કર્યાં દ્રાદશ અંગ રે;  
 હુઃખમ કાલમાં જેહનો, વિસ્તર્યો તીર્થ અતિ ચંગ રે. શા૦ ૨  
 પ્રથમ વાયણુ દિને શુંહણી, કરી ઈદ્રાણીએ સાર રે;  
 શાસન સંધ મંગલ લણી, એમ કરે શ્રાવિકા સાર રે. શા૦ ૩  
 સાથીએ મંગળ પૂરણો, ચૂરણો વિધન મિથ્યાત રે;  
 સધવા સહિયર સવિ મળી, સુખ થકી સુનિ ગુણુ ગાત રે. શા૦ ૪  
 આગમ આગમધર લણી, વધાવાની વાધતે ઢાળ રે;  
 વિચ વિચે લેત ઉવારણો, હર્ષતી બાળ ગોપાળ રે. શા૦ ૫  
 જે સુણે સૂત્ર લભક્તે કરી, તેહનો જન્મ કયત્થ રે;  
 માહરે જાવો લવ નિત હજે, દૈવચંદ્ર શુત સત્ય રે. શા૦ ૬

દૂપદ. ( પૂર્વ પ્રકાશિત સન્જાય સંગ્રહ )

આતમ લાવે રમો હો ચેતન ! આતમ લાવે રમો;  
 પરલાવે રમતાં હો ચેતન ! કાળ અનંત ગમો. હો ચેતન !૦ ૧  
 રાગાદિકશું મળીને ચેતન ! પુહગલ સંગ લમો;  
 ચઉગતિમાંહે ગમન કરંતાં, નિજ આતમને દમો. હો ચેતન !૦ ૨  
 શાનાદિક ગુણ રંગ ધરીને, કર્મકો સંગ વમો;  
 આતમ અનુભવ ધ્યાન ધરંતાં, શિવરમણીશું રમો. હો ચેતન !૦ ૩  
 પરમાત્મનું ધ્યાન કરંતાં, ભવસ્થિતિમાં ન લમો;  
 દૈવચંદ્ર પરમાત્મ સાહિબ, સ્વામી કરીને નમો. હો ચેતન !૦ ૪

### પંચેન્દ્રય વિષય ત્યાગ-પદ

ચેતન ! છોડ હે, વિષયનકો પરસંગ.

ગિરોધ ક્રિત વિદોદાલ ફરસ વશ, બંધોધ ક્રિત માતંગ. ચેતન !૦ ૧  
 કંઠ છેદાયો મીન અપનો, રસનાકે પરસંગ;  
 નેત્ર વિષય કર હીપ શિખાપૈ, જવ જલ મરત પતંગ. ચેતન !૦ ૨  
 ખટપદ જલજમાંહે ફ્રસ મૂરખ, જોયો અપનો અંગ;  
 વીણા શણ સુણુ શ્રવણુ તત્પિન, મોહી મર્યો રે કુરંગ. ચેતન !૦ ૩  
 એક એક ધંદ્રિય ચલત બહુ ફુઃખ, પાયો હૈ સરલંગ;  
 પાંચા ધંદ્રિય ચલત મહાફુઃખ, \* લાષત દૈવચંદ ચંગ. ચેતન !૦ ૪

### મુનિ ગુણુ સન્જાય

જગતમેં સદા સુખી મુનિરાજ, પર વિલાવ પરિણુતિકે ત્યાગી.  
 જગે આત્મ સમાજ, નિજ ગુણુ અનુભવકે ઉપયોગી;  
 યોગી ધ્યાન જહાજ, જગતમેં સદા મુખી મુનિરાજ. ૧  
 હિંસા મોસ અદત નિવારી, નહિ મેથુનકો પાસ;  
 દ્વાર્ય ભાવ પરિશ્રષ્ટકે ત્યાગી, લીને તત્ત્વ વિલાસ. જગતમેં ૦ ૨

\* ધમ ભાષત દૈવચંદ ધર્તિ પાડાંતરમ.

निर्लय निर्मल चित्त निराकुल, विलगे ध्यान अस्थास;  
देहादिक भमता सपि वारी, पिचरे सदा उदास. जगतमें० ३  
थडे आहार वृत्ति पात्रादिक, संज्ञम साधन काज;  
देवचंद्र आखुत्याची, निज संपत्ति महाराज. जगतमें० ४

### समकितनी सज्जाय

समकित नवि लहो रे, ए तो रुद्यो चतुर्गति भांडि.  
त्रस थावरकी करुणा कीनी, ज्व न एक विराध्यो;  
तीन काल सामाईक करतां, शुद्ध उपयोग न साईयो. समकित० १  
ज्वूठ ऐलवाडे व्रत लीनो, चोरीडे पण त्यागी;  
व्यवहारादिक निपुण लयो पण, अंतरहृष्टि न जागी. समकित० २  
उड्व लुजा क२ उधो लटके, लसम लगाई धूम घटके;  
जटा ज्वूट शिर सुडे ज्वूडे, विषु श्रद्धा लव लटके. समकित० ३  
निज पर नारी त्याग ज करके, अक्षयर्य व्रत लीनो;  
स्वगार्दिक याडे इल पाई, निज कारज नवि सीनो. समकित० ४  
आधु ठिया सभ त्याग परिणह, द०य लिंग धर लीनो;  
देवचंद्र कडे याविध तो हम, बहुत वार क२ लीनो. समकित० ५

### साधु पद सज्जाय

साधक साधजे रे, निज सत्ता एक चित्त;  
निज गुण प्रगटपणे ने परिणुमे रे, अेहिज आतम वित्त. साधक० १  
पर्याय अनंता निज कारज पणे रे, वरते ते गुण शुद्ध;  
पर्याय गुण परिणुमे कर्तृता रे, ते निज धर्म प्रसिद्ध. साधक० २  
परबावातुगत वारज चेतना रे, तेह वक्ता चाल;  
कर्ता लोकादिक सपि शक्तिमां रे, व्याख्या उलटो भ्याल. साधक० ३  
क्षयेपश्चमिक ऋजुताने उपने रे, तेहिज शक्ति अनेक;  
निज स्वलाव अनुगतता अनुसरे रे, आर्जव लाव विवेक. साधक० ४

અપવાહે પર વંચકતાદિકા રે, એ માયા પરિણુામ;  
 ઉત્સર્જ નિજ ગુણુની વંચના રે, પરલાવે વિશ્રામ. સાધક૦ ૫  
 સાતે વરળુ અપવાહે આજ્વિંગી રે, ન કરે કપટ કુષાય;  
 આતમ ગુણુ નિજ નિજ ગતિ હોરવે રે, એ ઉત્સર્જ અમાય. સાધક૦ ૬  
 સત્તા રોધ ભ્રમણુ ગતિ ચારમેં રે, પર આધીને વૃત્તિ;  
 વહુચાલથી આતમ દુઃખ લહે રે, જિમ નુપનીતિ વિરતિ. સાધક૦ ૭  
 તે માટે મુનિ ઋજુતાએ રમે રે, વમે અનાદિ ઉપાધિ;  
 સમતા રંગી સંગી તત્ત્વના રે, સાધે આતમ સમાધિ. સાધક૦ ૮  
 માયા ક્ષયે આજ્વિંગની પૂર્ણતા રે, સવિ ગુણુ ઋજુતાવંત;  
 પૂર્વ પ્રયોગે પરસંગીપણ્ણો રે, નહિ તસુ કર્તાવંત. સાધક૦ ૯  
 સાધન લાવ પ્રથમથી નીપજે રે, તેહિજ થાયે સિદ્ધ;  
 દ્વાર્યત સાધન વિધન નિવારણુ રે, નૈમિત્તિક સુપ્રસિદ્ધ. સાધક૦ ૧૦  
 ભાવે સાધન જે એક ચિત્તથી રે, ભાવ સાધન નિજ ભાવ;  
 ભાવ સિદ્ધ સામથી હેતુ તે રે, નિસસંગી મુનિ ભાવ. સાધક૦ ૧૧  
 હેય ત્યાગથી અહણુ સ્વર્ધમનો રે, કરે લોગવે સાધ્ય;  
 સ્વ સ્વલ્ભાવ રસિઆતે અનુભવે રે, નિજ સુખ અંયાબાધ. સાધક૦ ૧૨  
 નિઃસ્પૃહ નિર્બિય નિર્મિભ નિર્મિલા રે, કરતા નિજ સાઓજ;  
 દૈવચાંદ્ર આણુએ વિચરતા રે, નમિયે તે મુનિરાજ. સાધક૦ ૧૩

### ઢંઢણુ મુનિની સંજાય

ધન ધન ઢંઢણુ મુનિવરુ, કૃષ્ણ નરેસર પુતો રે;  
 ગુણુમણિ લવણિમ શોભતો, લખમી લીલા જુતો રે. ધન૦ ૧  
 ક્રોમલ કમલા કામિની, મૂકી એક હળરો રે;  
 નેમિ વચ્ચે વૈરાગીએ, લીધો સંજમ લારો રે. ધન૦ ૨  
 અહણુ ને આસેવના, સીધી શિક્ષા સારો રે;  
 વિચરતા આંયાજુ દ્વારિકા, નેમિ સાથે સુખકારો રે. ધન૦ ૩

એક દિન ગોચરી સંચર્યો, કરતા ગવેષણું શુદ્ધિ રે;  
 આહાર કાંઈ મિલ્યો નહિ, સુનિ મન સમતા બુદ્ધિ રે. ધનો ૪  
 સુનિ ચિંતે પુછભલ બળે, શ્યો નિજ શુણું અણ્યાસે રે;  
 ઉત્સર્ગો આતમ બળે, કીને શિવપદ વાસે રે. ધનો ૫  
 શક્તિ યથામેં આદરે, અપવાહે અનેકો રે;  
 સહજે જે સંવર વધે, તો ન થણે પર ટેકો રે. ધનો ૬  
 નિત પ્રતિ ગોચરી સંચરે, ન મિલે અજ્ઞ ને પાને રે,  
 પ્રભુ ચરણું આવી નમી, પૂછે તણું અભિમાનો રે. ધનો ૭  
 શું કારણું ? કહો નાથજી !, એવડો એ અંતરાયો રે;  
 જિન લાંઘે કૃત કર્મનો, એહુદો છે વ્યવસાયો રે. ધનો ૮  
 પૂરવ લવ ધન લોલથી, કીધો કૂર અપાયો રે;  
 તીવ્ર રસે જે બાંધીઆ, તેહનો ઇલ હુઃખદાયો રે. ધનો ૯  
 નૃપ આહેરો પાંચસેં, હળ એડવા અધિકારો રે;  
 ચાસ એક નિજ ક્ષેત્રની, એડાવી ધરી ખ્યારો રે. ધનો ૧૦  
 ભાત ચારીનો સર્વને, તુમે કીધો અંતરાયો રે;  
 તીવ્ર રસે જે બાંધીયો, તસુ વિપાક એ આયો રે. ધનો ૧૧  
 સુનિવર અભિથહ આદર્યો, એહ કરમ ક્ષય કીધે રે;  
 લેશું હવે આહારને, ધીરજ કારજ સીધે રે. ધનો ૧૨  
 માસ ગયા ષટ્ટ ઈણું પરે, પણ સુનિ સમતા લીનો રે;  
 અણુ પામે અતિ નિર્જરા, જણે તિણે નવિ હીનો રે. ધનો ૧૩  
 વાસુદેવ જિન વંદીને, પૂછે ધરી આનંદો રે;  
 સાધક સાધુમેં નિરમળો, કવણું ? કહો જિનચંહો ! રે. ધનો ૧૪  
 નેમિ કહે ઠંઢણું સુનિ, સંવર નિર્જરા ધારી રે;  
 સહુ સાધુ થકી અધિક છે, સમતા શુદ્ધ વિહારી રે. ધનો ૧૫  
 નિજ ધર આવતાં નરપતિ, વંધો સુનિ શમકંહો રે;

દીઠો તવ એક ગૃહપતિ, પાંચો હરખ આનંદો રે. ધન૦ ૧૬  
 મુનિ આંયા તસુ આંગણો, પડિલાલ્યા મનરાગે રે;  
 મોહક સૂજતા મુનિ અહી, ચહેતે મન વૈરાગે રે. ધન૦ ૧૭  
 જિન વંદીને પૂછીયો, તુલ્યો ? તે અંતરાયો રે;  
 નાથ કહે જહુનાથને, કારણુથી તુમે પાયો રે. ધન૦ ૧૮  
 સાંસળી મુનિ અતિ હુરખીયા, ધન ધન એ શુલુરાનો રે,  
 વીતરાગ ઉપગારીયા, કુપા કરી મુજ આનો રે. ધન૦ ૧૯  
 સાધ્ય અધૂરે કુણુ કરે, એ આહાર અસારો રે;  
 પુછગલ જગની એંઠ એ, કેમ લે મુનિ સુવિચારો રે. ધન૦ ૨૦  
 સાધન વધતે આદરે, એ સાધક વ્યવહારો રે;  
 નિષ્કારણ પર વસ્તુને, છીએ નહિ અણુગારો રે. ધન૦ ૨૧  
 એમ ચિંતવી શુદ્ધ થાંડિલે, પરઠવતા તે પિંડો રે;  
 પુછગલ સંગની નિંદના, નિજ શુણ રમણુ પ્રયંડો રે. ધન૦ ૨૨  
 પરપરિષુતિ વિચ્છેદટાં, નિજપરિષુતિ પ્રાગ્નભાવો રે;  
 ક્ષપકશ્રેષ્ઠી ધ્યાને રમ્યા, પાંચ્યા આત્મસવલાવો રે. ધન૦ ૨૩  
 આત્મ તત્ત્વ એકાશતા, તન્મય વીરજ ધારે રે;  
 ધનધાતી સવિ ઐરોયા, રત્નત્રયી વિસ્તારે રે. ધન૦ ૨૪  
 ક્ષીણુ મોહ કરી ચરણુની, ક્ષાયિકતા કરી પૂરી રે;  
 કેવલ જ્ઞાન દર્શન વર્યા, અંતરાય સવિ ચૂરી રે. ધન૦ ૨૫  
 પરમ દાન લાલ નીપનો, કીધો કારજ સૂધો રે;  
 સમવસરણુમેં આવીયા, સાધ્ય સંપૂરણુ સીધો રે. ધન૦ ૨૬  
 એહવા મુનિને ગાઈયે, ધ્યાઈયે ધરી આનંદો રે;  
 દેવચંદ્ર પદ પાઈયે, લહીયે પરમાનંદો રે. ધન૦ ૨૭

**દ્રાવિક-વારિભિલલ મુનિ-સનજાય.**

ધન ધન મુનિવર ને સંજમ વર્યા છુ, પરિહર્યા પાપ અઠાર રે;

સમતા આહરી મુનિ ભમતા તળ લુ, સમ્યક્ષ ક્ષમા દ્યા ભંડાર રે. ધ૦  
જગ્ધલ વંશ દ્વિદ નૃપ પુત્ર એ લુ, દ્વાવિદ અને ખીલે વારિભિલ્લ રે;  
ભૂમિનિમિત્તે રણ રસીયા થકા લુ, તાપસ સંચોગે કાઢ્યો સદ્ગુરુ રે. ધ૦  
સંજમ લીધો લટ દશ કેડિથી લુ, પહેંતા સિદ્ધાચળ ગિરિશૂંગ રે;  
આણુસણુ કરી નિજ તત્ત્વે પરિણુભ્યા લુ,

ત્રિવિધ ત્રિવિધ વોસિરાવી સંગ રે. ધન૦ ૩  
રત્નત્રયી રમી આતમ સંવરી લુ, ઓળખી છંડ્યો સર્વ વિલાવ રે;  
પ્રત્યાહાર કરી ધરી ધારણા લુ, વલગ્યા નિર્મણ ધ્યાન સ્વલાવ રે. ધ૦  
મૈત્રી લાવ લળ સવિ જીવથી લુ, કરણા લાવ હુઃખીથી તેમ રે;  
પંચ ગુણીની નિત્ય પ્રમોદ્તા લુ, શુલાશુલ વિપાકે મધ્ય પ્રેમ રે. ધ૦  
પિંડસ્થે શ્રી અરિહુંતાદિક તણી લુ, સુદ્રા આસન શુલગાકાર રે;  
ધ્યાતા અતિશય ઉપગારીપણું લુ, ધ્યાન પહસ્થ ધયો સુવિચાર રે. ધ૦  
નિર્મણ સિદ્ધ સ્વલાવે તન્મથી લુ, જાનાદિક ગુણથી થિર લાવ રે;  
સિદ્ધ શુદ્ધ ગુણી ગુણુ ગાવતાં લુ, અવલંઘ્યો ઇપસ્થ સ્વલાવ રે. ધ૦ ૭  
(સ્વ)સત્તાગત આતમ ગુણુ એકતા લુ,

ધ્યાતા નિજ ગુણુ (દ્રોય) પર્યાય રે;  
બેદ સ્વલાવે થછ અલેદ્તા લુ, તન્મય તત્ત્વે મોહ વિલાય રે. ધ૦ ૮  
મોહ ક્ષયે ધાતી દળ ક્ષય ગયા લુ, પાભ્યા નિર્મણ કેવળજ્ઞાન રે;  
સિદ્ધ થયા દસ કોડી મુનીસરુલુ,

કાર્તીક શુદ્ધ પુનમ દિનમાન રે. ધન૦ ૯  
કાર્તીક શુદ્ધ પુનમ જે સિદ્ધાચળે લુ, વંદે પૂજે ધન નર તેહ રે;  
ઉત્તમ ગતિ પામી શિવસુખ લહે લુ,

થાયે તે અનુપમ સુખ ગેહ રે. ધન૦ ૧૦  
સિદ્ધાચળ સિદ્ધા મુનિરાયને લુ, ગાવો ધ્યાવો ધરી આણુંદ રે;  
સફુરુ પાઠક શ્રી દીપચંદ્રનો લુ,

શિષ્ય ગણ્ય લાંખે દૈવચંદ રે. ધ૦ ૧૧

## જૂઠ ત્યાગ વિષે સન્જાય.

મોહ વશો શ્રવણે સુણ્યા રે, ઓહ્યા હુઃખનો ધામ;

ધવજ કોલક ઈણુ સંગથી રે, ઈણુ લવ સાધે કામ. ચતુર નર !  
પરિહર વચન અલીક, એ તો હુઃખદાયક તહુકીક. ચતુર નર !

પરિ૦ ૧

જૂઠ કથકનો સુખ કદ્દ્યો રે, નગરની છાર સમાન;

તિરિય નરય ગતિમેં લમે રે, પામે હુઃખ વિષુ જ્ઞાન. ચતુર૦ ૨  
શીતલ ચંદન ચંદ્રથી રે, મીઠી વાણી સુહાય;

દવ દાહ વલી પાલવે રે, વચન દાહ ન ખમાય. ચતુર૦ ૩  
મધુર વચન જગ પ્રિય છે રે, કટુક સત્ય પણ છોડ;

મધુર સત્ય ભાષી તણે રે, હરિસણુથી સુખ છોડ. ચતુર૦ ૪  
શુચિનાહી નર જે અછે રે, સફળ જન્મ તસુ ધાર;

જૂઠાખોલા માનવી રે, કેમ ઉતરે લવ પાર ? ચતુર૦ ૫  
ત્રત શ્રુત સંજમલારનો રે, સત્ય વચન છે કોષ;

દેવ દાનવ ન કરી શકે રે, તે ઉપર તિલ દોષ. ચતુર૦ ૬  
આનંદ કરીએ ચંદ્ર જયું રે, પાય નમે જસુ દેવ;

રૂપ જલિ ધન હીન જયું રે, તેહને એહીજ ટેવ. ચતુર૦ ૭  
તાપસ ચોળી મૂંડીયા રે, નાગા ચીવર ધાર;

કૂડ વચન કહેતા થકા રે, તે છે પાતકાર. ચતુર૦ ૮  
ખાદ્ય ધન પરિવાર જે રે, તોય ન એવે અલીક;

અન્ય પુષ્ય સહુ તોલતાં રે, તોહી ન એ સમ ઢીક. ચતુર૦ ૯  
ખહિરા શાઠ ને એખડો રે, જ્ઞાન હીન સુખ રોગ;

ચોની વલી ખર શ્વાનની રે, પામે કૂડને ચોગ. ચતુર૦ ૧૦  
સાતાદિક શુણુ ગણુ તણું રે, કૂડ કરે છે હાણુ;

સુહણે સંગ ન કીળાયે રે, જ્યૂઠ વચન હુઃખ ખાણુ. ચતુર૦ ૧૧  
 વંદનીક ત્રય જગતમેં રે, વધે દ્વય પરિવાર;  
 સત્ય વચનથી સુખ લહે રે, શુચિવાહી અણુગાર. ચતુર૦ ૧૨  
 પર કારણુ વચ જ્યૂઠનાં રે, એલાયાં હે હુઃખ લક્ષ;  
 અસત્ય વચનથી હુઃખ લદ્ધા રે, વસુ રાજ પરતક્ષ. ચતુર૦ ૧૩  
 માનવ દાનવ સુરપતિ રે, થહુ ઐચર જનપાલ;  
 વહે જિન તે પણુ કહે રે, સત્ય વચન વ્રત પાંઠ. ચતુર૦ ૧૪  
 સત્ય વચનથી સુખ લહે રે, સત્ય વચન સુખ ખાણુ;  
 અદ્ય વચન કહો પ્રાણીયા રે, દૈવચંદ્રની વાણુ. ચતુર૦ ૧૫

### ચોરી ત્યાગ વિષે સંજાય.

પર ધન આમિષ સારિએ રે, હુઃખ હે પજગ જેમ;  
 તસુ વિશ્વાસ ન કો કરે રે, તો આહરીએ કેમ. ચતુર નર !  
 પરિહર ચોરી સંગ, ચોરીથી હુઃખ ઉપજે રે,  
 વલી હોય તનનો લંગ. ચતુરનર ! પરિ૦ ૧  
 ભાત પિતા સુત ભિતરી રે, તૂટે તેહનો નેહ;  
 માનવથી ડરતો રહે રે, મૃગ જેમ લયનો ગેહ. ચતુર નર૦ ૨  
 ક્ષણુ એકુ નિંદ કરે નહિ રે, મરણુ થકી લયભ્રંત;  
 જો કો મુઅને જાણુશો રે, તો કરશો મુઅ અંત. ચતુર નર૦ ૩  
 વિદ્યા શુરૂવાઈ અમે રે, નિજ રક્ષણુ નવિ થાય;  
 સંજજન પણુ નિંદા લહે રે, તસ્કર સંગ પસાય. ચતુર નર૦ ૪  
 ધાત કરે તૃણની પરે રે, ચોર લણી સહુ લોક;  
 પાંડિત પણુ મૂરખ હુવે રે, મુનિ પણુ પામે શોક. ચતુર નર૦ ૫  
 ધોર નરક હુઃખ હે સહી રે, ચોરી કેરી ઝુદ્ધિ;  
 ચોહની સંગતિ તે તજે રે, જે ચોહે નિજ શુદ્ધિ. ચતુર નર૦ ૬  
 ગિરિ શુક્ષા રણુમેં પજા રે, પર ધન લીજે નાહિ;

તુણુ સમ પણ પર વસ્તુની રે, મત મન ધરજે ચાહિ. ચતુર નર૦ ૭  
શિવસુખની જો ચાહ છે રે, રાખણ ચાહે ધર્મ;  
સુખ ચાહે કૃષુ-પરલવે રે, તો તજ એહ કુકર્મ. ચતુર નર૦ ૮  
વિરતિ મૂલ યમ સાખ છે રે, સંયમ હલ સમ કૂલ;  
પંડિત જન પંખી અછે રે, ઇલ તે જ્ઞાન અમૂલ. ચતુર નર૦ ૯  
ધર્મ વૃક્ષ એહવો દહે રે, ચોરી મત મન આણિ;  
પર ઉપગારી આદરે રે, દૈવચંદ્રની વાણિ. ચતુર નર૦ ૧૦

**અહાયાર્થ િવષે.** ( બંધવ ગજ થકી ઉતરો-એ દેશી )

કુડ કપ્પટ ધર એ ત્રિયા, તિનકો સંગ નિવાર રે ભાઈ !  
મૈથુન હુઃખાયક તજી, આતમ શુણ સંભાર રે ભાઈ ! ૧  
નારી સંગ તજો તુમે, નારી હુઃખની ખાણ રે ભાઈ !  
નારી સંગે હુઃખ હુવે, એ શ્રી જિનવર વાણ રે ભાઈ ! નારી૦ ૨  
પુથત વહે જસુ દેહથી, કાચો પ્રણ વહે જેમ રે ભાઈ !  
તેમ સ્વીયોનિ અશુચિ ધરે, તિણુ પર રાચો કેમ રે ભાઈ ! નારી૦ ૩  
મૂત્ર ગેહ હુરગંધ છે, નારી લગ હુઃખ ખાણી રે ભાઈ !  
મૂરખ રંગ ધરે તિહાં, નવિ રાચે ધસુ નાણી રે ભાઈ ! નારી૦ ૪  
શ્વાન રૂધિર નિજ જેમ પીયે, સુખ માને મનમાંહ રે ભાઈ !  
કામી તેમ સ્વી સંગથી, ચિત્ત ધરે ઉત્સાહ રે ભાઈ ! નારી૦ ૫  
નારી યોનિ અશુચિ અછે, નારી હુર્ગતિ માર્ગ રે ભાઈ !  
આદર નં હે કો વૃદ્ધને, તો તરુણુ ઉપર રૂચો રાગ રે ભાઈ ! નારી૦ ૬  
સહૂથી જોરાવર અછે, નારી અખલા નામ રે ભાઈ !  
યોનિકાર હુઃખદ્વાર છે, પંડિત તજનો વામ રે ભાઈ ! નારી૦ ૭  
લોગવતાં તનુ નારીનાં, લાગે છે સુકુમાલ રે ભાઈ !  
સૂલીથી કરડી અછે, ઉહ્યાગત એ કાલ રે ભાઈ ! નારી૦ ૮  
મૈથુન સેવતાં થકાં, જીવ મરે લખ કોડી રે ભાઈ !

મહાનિરીથે હાખોયા, યોનિ લિંગને જેહી રે ભાઈ ! નારી૦ ૮  
 હુરગંધ મલધર લયકરુ, મંડૂકી આકાર રે ભાઈ !  
 ચરમરંપ્ર નારી તણ્ણે, રાગ કિસો ? વિષુ સાર રે ભાઈ ! નારી૦ ૧૦  
 સર્વ અશુયિમય નિંદ્ઘ એ, હુરગંધ નારી એહ રે ભાઈ !  
 રાચે મૂર્ખ માનવી, પંડિત વિરમે જેહ રે ભાઈ ! નારી૦ ૧૧  
 કુથિત ભૃતક ગંધ યોનિ છે, કુમિ કુલ પૂરણ એહ રે ભાઈ !  
 ક્ષર મૂત્ર જરતી રહે, તિણુ ઉપર શ્યો નેહ ? રે ભાઈ ! નારી૦ ૧૨  
 એહ સ્વરૂપ જાણી તજે, પંડિત ખીનો સંગ રે ભાઈ !  
 મહન મોહ જીપી લહે, દૈવચંદ્ર પદ રંગ રે ભાઈ ! નારી૦ ૧૩

### મનો-નિયહ વિષે સંજાય.

કુશલ લાલ મન રોધથી રે લાલ, આતમ તત્વ સન્નાહ, રે સુગુણુ નર;  
 આપા પર વંચે જિકે રે લાલ, નિજ મન થિરતા સાહ રે સુ૦ ૧  
 મન ગજ વશ કરે જ્ઞાનશું રે લાલ, મન વશ વિષુ શિવ નાંહ રે; સુ૦  
 ધ્યાન સિદ્ધ મન શુદ્ધથી રે લાલ, જાંજે લવ હુઃખ દાહ રે સુ૦ મન૦ ૨  
 તીન ભુવન તસુ દાસ છે રે લાલ, જસુ વરી મન માતંગ રે સુ૦  
 મુક્તિ ગેહ તે જન લહે રે લાલ, જસુ મન છે નિઃસંગ રે સુ૦ મન૦ ૩  
 જેમ મનની શુદ્ધિ હુવે રે લાલ, તેમ તેમ વાધે વિવેક રે સુ૦  
 શિવ ચાહે મન વશ વિના રે લાલ,

મૃગ-તૃષ્ણા સમ લેક રે સુ૦ મન૦ ૪  
 જ્ઞાન ધ્યાન તપ જપ સહુ રે લાલ, મન થિર કીધાં સાચ રે; સુ૦  
 જગ હુઃખદાયક મન અછે રે લાલ, વિષય આમભેં રાચ રે સુ૦ મન૦ ૫  
 જ્ઞાન પરાક્રમ ઝોરવી રે લાલ, વશ કરી મન ગજરાજ રે સુ૦  
 નવ વન મન કપિ જિષુ દર્શ્યો રે લાલ,

તસુ સિદ્ધા સવિ કાજ રે સુ૦ મ૦ ૬  
 મન ગજ વશ ન કરી શકે રે લાલ, તસુ ધ્યાનાદિક એહ રે; સુ૦

જે ન સાધે શુત તપ થકી રે લાલ, મન થિર સાધે તેહ રે સું મનો ૭  
અનંત કર્મ ચડ લેદના રે લાલ, મન થિર કીધાં જાય રે સું  
જસુ મન થિર તે શિવ લહે રે લાલ, દ'ડા શાને કાય રે સું મનો ૮  
શુત તપ યમ મન વશ વિના રે લાલ, તુસ ખંડન સમ જાણુ રે; સું  
મન વશ વિણુ શિવ નવિ લહે રે લાલ,

મન વશો શિવસુખ ઠાણુ રે સું મનો ૯  
મન વશો નિર્ણય શુણુ લહે રે લાલ, જિણુ વિણુ સહુ શુણુ જાય રે; સું  
તીન લુવન જીવ્યા મને રે લાલ, મન જ્યકાર કો થાય રે સું મ૦ ૧૦  
શુતધર પણુ મન વશ વિના રે લાલ, નવિ જાણે નિજ ઝૃપ રે; સું  
શાંત વિષય વશ મન કરી રે લાલ, સુનિ થાયે શિવ ભૂપ રે સું મનો ૧૧  
સ્વર્ગ મૃત્યુ પાતાળ મેં રે લાલ, દ્વીપ ઉદ્ધિ ગિરિસીસ રે; સું  
તીન લોકમેં નવી જમે રે લાલ, દેવચંદ્ર ગત રીસ રે સું મનો ૧૨

### ધ્યાની નિર્ણય વિષે.

દ્વાહા.—પરમારથ નિશ્ચય કરી, વધતે મન વૈરાગ;

ઇદ્રિય સુખ નિર્ણય થકા, સાધુ ઈસા વડલાગ. ૧

ભાવ શુદ્ધ લવભરમણુથી, ધૂટા ને જોગીશ;

કામ લોગથી ઉભયા, તનની સ્પૃહા ન રીશ. ૨

પ્રાણુ ત્યાગ પણ ધ્યાનથી, ધૂટે નહિ લગાર;

પર ત્યાગી સુનિવર તિકે, ધ્યાનતણુ આધાર. ૩

મહા—પરિસહ સાપથી, જન નિંદાથી જાસ;

ક્ષોભ ન પામે મન તનક, વસતા નિંજ શુણુ વાસ. ૪

રાગ દ્રેષ રાક્ષસ થકી, લય નવિ પામે જેહ;

નારીથી મન નવિ ચલે, અક્ષય નિજ રસ ગેહ. ૫

તપ દીપકની જયોતિથી, બાલ્યા કર્મ પતંગ;

શાન રાજ્ય ત્રય લોકનો, વિલસ જેહ નિઃસંગ. ૬

તપथી તનને પીડવે, ઉપશમ રસ લાંડાર;

દ્વાક સર્વ સુખકાર જે, મોહ અજિન જળધાર. ૭

નિજ સ્વભાવ આનંદમથ, શાંત સુધારસ ઠામ;

ચોગ મહાગજ લુપને, પ્રતધારી શમ ધામ. ૮

દાળ-તાર મુજ તાર સંસાર સાગર થકી-એ હેઠી.

મહા શમધાર સુખકાર સુનિરાય જે, ધ્યાન ધ્યાવા લણી જોગ થાવે;  
દેહ આધાર સંસાર સુખ નિરપૃણી, તેહ જોગીશ નિજ હેવ પાવે. મ૦૧  
શુદ્ધ વિજ્ઞાન રસ પાનથી શાંત મન, થાવર જંગમ હ્યા ધારી;  
મેરુ જેમ અચલ આકાશ જેમ નિર્મલા,

પવન જેમ સંગ વિષુ દ્વાલ વારી. મ૦ ૨  
ભીય સારંગ સુખકાર ઉપદેશથી, દેહ શોલા તજ મોક્ષ સાધે;  
જીબ શક્તિ કરી આત્મ નિજ ચોકાખે,

શુદ્ધ નિજ ધ્યાન તે મુનિ આરાધે મ૦ ૩  
એમ નિજ હેવને મોક્ષ ગૃહ ચદણુને, કહી સોપાન સમ સાધુ સેવા;  
ધ્યાન તે સાધુને મોક્ષ કારણ કથ્યો,

વિમળ વિભ્યાત નિજ ગુણુ વહેવા. મ૦ ૪  
દાંત મન વિહૃગ ઈદ્રિય લણી જે દમે, જીબના ગોહ પાતક વિડારે;  
કર્મ દલ ગંજને ચિત્ત નિરમદ્દ થકા,

એમ જોગીશ શિવ મગ સુધારે. મ૦ ૫  
ગિરિ નગર કંદરા ગોહ શથ્યા શિલા, ચંદ્રકર દીપ મૃગ સંગ ચારી;  
જીબ જલ તપ અદીન શાંત આત્મા થકા,

ધન્ય નિર્ઝંથ સુવિહિત વિહારી મ૦ ૬  
પ્રાણુ ઈદ્રિય વલી દેહ સંવર કરી, રોકી સંકદપ મન મોહ બંજી;  
ધન્ય નિજ ધ્યાન આનંદ આલંબ ધરી,

- શુદ્ધ પદ આત્મની જયોતિ ૨ંજ. મ૦ ૭

હેય આહેય ત્રિભુવન ગણે સાધુ જે, ક્ષય કરે પુષ્ટયને પાપ કરેલા;  
આત્માનાં દસ્યાદ્વારથી વિષયને, વિષ ગણી ભંજતા કર્મ ઘેરો. મ૦ ૮  
કાર્ય સંસારના સાધતા જ્ઞાન વિષુ, જગતમેં એહવા બહુત હીસે;  
કાપી ભવ હુઃખ વલી જ્ઞાન જલ જીવતા,

એહવા સાધ હોય તીન હીસે.      મ૦ ૯

અડે પ્રાસાદમેં નરમ પદ્યંક પર, રાત જે પોઠતા નારી સંગે;  
તેહ ગિરિ કંદરા કઠીન શિલા પરે, રહેનિત જગતા ધ્યાન રંગે. મ૦ ૧૦  
ચિત્ત થિર રાગ ને દ્રેષને ક્ષય કરો, જ્ઞાપ ઈદ્રિય આરંભ છોડી;  
જ્ઞાન ઉદ્દીપના થકી આનંદમય, હેખી નિજ દેવને કર્મ મોડી. મ૦ ૧૧  
છોડી પરસંગ આત્મા ભણી સિદ્ધ સમ, ધ્યાવતા સુમતિસું મોહ વારે;  
આત્મ સ્વભાવ ગત જગત સહુ અન્ય ગણી,

જ્ઞાનનિધિ મોક્ષ લક્ષ્મી સુધારે. મહા૦ ૧૨  
તત્ત્વચિંતા કરે વિષયને પરિહુરે, સ્વહિતનિજ જ્ઞાન આનંદ દરીઓ;  
સુમતિ સંયુક્ત તપ ધ્યાન સંયમ સહિત,

એહવો સાધ ચારિત્ર લરીયો.      મ૦ ૧૩  
એહવા પંડિતો વચન રચના થકી, નિત શુણે આત્મને બહુત એસા;  
શુદ્ધ અનુભૂતિ આનંદસ્ફુર રાચીયા, કટે લવ પાસ હુરલંબ તેસા. મ૦ ૧૪  
એહવા ચોગધારી જિકે સુનિવરુ, ધ્યાન નિશ્ચલ તે કેર્જ રાખે;  
ધ્યાન ને ચોગ અણુચોગની એ કથા, અંથ અનુસાર દેવચંદ્ર લાંઝે મ૦ ૧

### શુદ્ધિપત્રકો.

પત્રાંક	લીટી	અશુદ્ધ	શુદ્ધ
૬	૨	જળ	જેમ જળ
"	"	ધન નિજ	ધન
૩૦	૧૭	પજન્તુજ	પજન્યુજ

